



DATE: 26.08.2021

To,

The National Stock Exchange of India Limited, Exchange Plaza, Plot no. C/1, G Block, Bandra-Kurla Complex Bandra (E), Mumbai-400051

SUB: PUBLIC NOTICE REGARDING CIRCULATION OF "UNSOLICITED MASSAGES" WITH REFERENCE TO THE EQUITY SHARES OF THE COMPANY

In continuation of our reply dated 24.08.2021 regarding above cited subject, we further write to inform you that company has published a public notice in the Financial Express (English & Gujarati) on 25.08.2021 & 26.08.2021 respectively titled <u>PUBLIC NOTICE</u> regarding circulation of "Unsolicited Massages" with reference to the equity shares of the Company to induce investment in the equity shares of the Company indicating target prices, by some unregistered or unauthorized entities

Kindly take the same on your record.

Thanking you.

Yours faithfully
For, SAGARDEEP ALLOYS LIMITED
JAYESHKUMAR
ASHMAL MEHTA
Membranish and the common and the commo

WHOLETIME DIRECTOR
[DIN: 02156140]

કાયનાન્સિયલ એક્સપ્રેસ

પ્રીમિયર સિન્થેટીક્સ લીમીટેડ

CIN - L99999GJ1970PLC100829 **રજીસ્ટર્ડ ઓફીસ** : સુરાના હાઉસ, ક્લાસીક રોમ્બર પાછળ, સ્વસ્તીક ક્રોસ રોડ, -નરનારાયણ કોમ્પેલેક્ષ સામે, નવરંગપુરા, અમદાવાદ– ૩૮૦૦૦૯, ગુજરાત.

નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે પ્રિમિયર સિન્થેટીક્સ લીમીટેડના સભ્યોની પ૧મી વાર્ષિક સામાન્ય સભ મંગળવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ ૦૨.૩૦ કલાકે સુરાના હાઉસ, ક્લાસીક ચેમ્બર્સ પાછળ, સ્વસ્તિક ક્રોસ રોડ, નારાયણ કોમ્પલેક્ષ સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯, ગુજરાત ખાતે યોજાશે. વાર્ષિક અહેવાલ કંપનીની નોટીસ વેબસાઇટ https://www.premiersyntheticsltd.com/annual- report.php અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે <u>https://www.bseindia.com/stock-share-price/premier</u>-

૫૨ ઉપલબ્ધ રહેશે એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્ર અન્વયે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને ૫૧મી એજીએમની નોટીસ અને ૩૧મી માર્ચ, ૨૦૨૧ ના રોજ પુરા થતાં વાર્ષિક અહેવાલ તેમજ નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ના ઓડિટેડનાણાંકિય નિવેદનોની ફ્રીઝીકલ નકલોની સ્વાનગીમાં રહેલ મુશ્કેલીઓને પગલે સભ્યોને ઇમેઇલથી મોકલાઇ રહી છે. તે જે સભ્યોએ પત્રવ્યવહારને હેતસર કંપની/ડિપોજીટરી પાર્ટીશીપન્ટ(ટો)/ આરીટએ પાસે તેમના ઇમેઇલ આઇડી રજીસ્ટર્ડ કરાવ્યા છે તેમને ઇમેઇલથી મોકલવામાં આવશે

synthetics-ltd/premsyn/509835/corp-announcements ના કોર્પોરેટ એનાઉન્સમેન્ટ ટેબ્

કંપની કાયદા. ૨૦૧૩ ની કલમ ૯૧ અને કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો. ૨૦૧૪ ના નિયમ ૧૦ની જોગવાઇઓ મુજબ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ બુધવાર ૨૨ સપ્ટેમ્બર ,૨૦૨૧ થી મંગળવાર ૨૮ સપ્ટેમ્બર. ૨૦૨૧ સધી (બંને દિવસો સહીત) બંધ રહેશે.

કટ ઓક તારીખ એટલે કે ૨૧ સપ્ટેમ્બર. ૨૦૨૧ ના રોજ કીઝીકલ સ્વરૂપે અથવા ડીમટીરીયલાઇઝડ સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો સીડીએસએલની ઇલેક્ટ્રોનિક વોટીંગ સીસ્ટમ (રીમોટ ઇ-વોટીંગ) દ્વારા એજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પર ઇલેક્ટ્રોનિકલી તેમના મતો આપી શકે છે. રીમોટ ઇ-વોટીંગ ૨૫ સપ્ટેમ્બર ,૨૦૨૧ (સવારે ૦૯.૦૦ વાગ્યે) શરૂ થશે અને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ (સાંજે ૦૫.૦૦ વાગ્યે) પુર્ણ થશે.

વાર્ષિક અહેવાલની સ્વાનગી પછી અને બુક ક્લોઝ પહેલા શેરો પ્રાપ્ત કરનાર સભ્યં helpdesk.evoting@cdslindia.com ઉપર અરજી મોકલીને યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. પોલિંગ પેપર મારફત મતદાનની સવલત વાર્ષિક સમાન્ય સભાના સ્થળે ઉપલબ્ધ કરાવામાં આવશે. જે સભ્યોએ રીમોટ ઇ-વોટીંગથી તેમના મત આપેલ છે તેઓ સભામાં હાજર રહી શકે છે પરંતુ ફરીથી તેમના મત આપવા હકદાર ગણાશે નહી.

પરિણામો તેમજ સ્ક્રુટીનાઇઝરનો અહેવાલ કંપનીની વેબસાઇટ મતદાનના www.premiersyntheticsltd.com ઉપર મુકવામાં આવશે અને બીએસઈ લીમીટેડને જાણ કરવામાં આવશે.

પ્રીમિચર સિન્થેટીક્સ લીમીટેડ વર્ત

તારીખ: ૨૫.૦૮.૨૦૨૧ સ્થળ: અમદાવાદ

રાહી/-વિસ્મય મકવાણ કંપની સેક્રેટરી

CENTRAL WAREHOUSING CORPORATION No. CWC / HYD /I-Outsourcing / Admn. / 2021-22/

NOTICE INVITING E-TENDERS

cewacor, www.tenderhome.com and www.eprocure.gov.in

CIN: L29253GJ2007PLC050007

Registered Office: Plot No. 2070, Rajnagar Patiya, Santej Khatraj Road, Santej

જાહેર નોટીસ

કંપનીને કેટલાક બિનસત્તાવાર અથવા બિન અધિકત વ્યક્તિઓ પાસેથી. કિંમતોને લક્ષમાં રાખીને કંપનીન ઇક્વીટી શેરોમાં રોકાણને પ્રલોભન આપવા માટે કંપનીના ઇક્વીટી શેરોને સંદર્ભિત ''અનિચ્છનીય મેસેજો ''ના પ્રમારાગની જાણ કરતો હમેહલ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓક હન્ડિયા લીમીટેડ (એનએસહ) દ્વારા મળેલ છે અમે સંપુર્ણપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કંપની, તેના પ્રમોટર, પ્રમોટર ગૃપ, ડાયરેક્ટર્સ અને કેએમપીએસ ત્રજાણી વ્યક્તિઓ/સંસ્થાઓ દ્વારા કરાયેલ આવા મેસેજોના પ્રસારણમાં કોઇ ભુમિકા ધરાવતા નથી અને એનએસઇ દ્વારા આ અંગે જાણકારી મળી હોવાથી કંપની તે સંબંધિત પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા

તમામ શેરહોલ્ડરો અને રોકાણકારોને આથી અનઅધિકૃત સંસ્થાઓ દ્વારા પ્રસારીત કરતાં આવા અનિચ્છનીય મેસેજો/એસએમએસ પર ભરોસો ન મુકવા સલાહ છે. અમેં શેરહોલ્ડરો અને રોકાણકારોને કંપનીના શેરોમાં ટ્રેડિંગ બને/અથવા રોકાણ કરતાં પહેલા યોગ્ય ચકાસણી કરવાની પણ સલાહ આપીએ છીએ અને આવા કોઇપણ પ્રનિચ્છનીય મેસેજ/એસએમએસથી પ્રભાવીત થયા વગર રોકાણના નિર્ણયો અંગે જાણકારી લેવા વિનંતી છે. જો કોઇપણ રોકાણકાર આવા મેસેજ/એસએમએસના આધારે કંપનીના શેરોમાં કોઇપણ રોકાણના સોદા કરે છે પ્રથવા નુકશાન ભોગવે છે, તો કંપની, તેના પ્રમોટર્સ, ડાયરેક્ટર્સ અને કંપનીના કોઇપણ અધિકારી તેના માટે જવાબદાર અથવા કસુરવાર ગણાશે નહી.

કંપની સમયાંતરે તમામ આવશ્યક ખુલાસાઓ કરી રહી છે અને તે એનએસઇની વેબસાઇટ અને કંપનીની

TP NORTHERN ODISHA DISTRIBUTION LIMITED TPNODL NOTICE INVITING TENDER (NIT)

The TP Northern Odisha Distribution Limited invites tenders (2 part bidding) from eligible vendors for the

S. No.	Tender Enquiry No.	Work Description	Tender Fee/ EMD Amount (in Rs.)	Last date of of FEE Submission	Last Date of Bid Submission
	TPNODL/OT/2021-22/ 055 Dtd.23.08.2021	Rate Contract for Enforcement related activities in PAN TPNODL Area	5000/ 2,00,000	02.09.2021	09.09.2021
	TPNODL/OT/2021-22/ 057 Dtd.23.08.2021	Rate Contract for Manufacture & Supply of 33/11kV 3.15 / 5.00 / 8.00 MVA Power Transformer	5000/ 10,00,000	02.09.2021	06.09.2021
3.	TPNODL/OT/2021-22/ 059 Dtd.23.08.2021	Rate Contract for Supply of 1-Phase & 3-Phase Meter Box	5000/ 7,00,000	10.09.2021	13.09.2021

For detailed tender documents, please visit Tender section on website: https://www.tpnodl.com(Tender). Interested bidders to submit Tender Participation Fee and Authorization Letter through email before tabulated timings above, after which link from TPNODL e-tender shall be shared. All future communication regarding the ender, bid submission, Corrigendum/ Amendment etc will be done with participating bidders only, through TPNODL E- Tender system. Sd/- VIPIN CHAUHAN, H.O.D.- Contracts

હરાજી સહ વેચાણની જાહેર નોટીસ (પરિશિષ્ટ–૪ એ) (નિચમ ૮ (૬)

સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ **આઇઆઇએફએલ હોય ફાયનાન્સ લીપીટેડ (અગા6 ઇન્ડિય** ઇ**ન્ફોલાઇન હાઉસિંગ ફાયનાન્સ લીપીટેડ તરીકે જાણીતી)(આઇઓફએલ એચએફએલ**)ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ સિક્યોર્ડ એસેટનો કબજો લીધા અન્વયે, નીઃ

દેવાદાર(રો)/	માંગણા નોટીસની	રથાવર મિલકતની	સાંકેતિક કબજાની તારીખ	રિઝર્વ કિંમત
જામીનદાર(રો)	તારીખ અને રકમ	વિગત	૧૪ નવેમ્બર, ૨૦૧૮	₹1. ₹3,00,000/−
૧) શ્રી દિનેશકુમાર		ફ્લેટ નં.ડી–૨૦૩, બીજો માળ, ડી–વિંગ, એ ટાવર, સંગીની સ્કાયઝ, નવરચના ઇન્ટરનેશનલ સ્કુલ		(રૂપિયા શ્રૈવીસ લાખ પુરા)
લાલશંકર તૈલી ૨. શ્રીમતી રૅદ્રિકાબેન લાલશંકર તૈલી (પ્રોસ્પેક્ટસ નં. ૪૮૬૫૮ ૪		પાસે, વાસણાભાચેલી રોડ, ગામ–ભાચેલી, તાલુકો અને જિલો–વાડોદરા, ગુજરાત–૩૯૦૦૦૭ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. (એરિયા ૭૧૬ થો. ફુટ)	રૂા. ૨૮,૩૫,૬૧૦/– (રૂપિયા અઠચાવીસ લાખ	અનેંસ્ટ મની ડિપોઝીટ (ઇએમડી) રૂા. ૨,૩૦,૦૦૦/– (રૂપિયા બે લાખ ત્રીસ હજાર પુરા)

૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સવારે ૧૧.૦૦ થી બપોરે ૦૧.૦૦ કલાકે ૧૭ સપ્ટમ્બર, ૧૦૩૦ વા ૧૦.૦૦ વાલ | ૧૭ સપ્ટમ્બર, ૧૦૨૧ તાવરે ૧૧.૦૦ શ્રી ભપોરે ૦૧.૦૦ કલાક સંબંધિત શાખા : આઇઆઇએકએલ હોમ કાચનાન્સ લીમીટેડ, ૩૦૩, ત્રીજો માળ, ભગવાનદાસ શ્રેમ્બર્સ, સર્કિટ હાઉસ સામે, આર. સી. દત્ત રોડ, વડોદરા, પીન–૩૯૦ (સંપક્કર્તા વ્યક્તિ :અંશુલ જુનેજા @૯૯૨૯૯૯૯૩૦૬)

ા. સ્થાવર મિલકતના નિસ્થિણની તારીખ ૧**૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૪:૦૦** દરમિયાન છે. ૨. શાખા ઓફીસના સરનામા પર નિયત ટેન્ડર ફોર્મમાં સીલબંધ ઓફરો તેમજ ઇએમડી જમા કરવાની છેક્ષી તારીખ ૧૭ **સપ્ટેમ્બર, ૨૦૨૧** ના રોજ સાંજે પ વાગ્યા સુધી *છે.* ૬. મિલકતની ઓફરો ખુલવાની તારીખ ૨૦ **સપ્ટેમ્બર, ૨૦૨૧** ના રોજ ઉપર જણાવેલ શાખાના સરનામે સવારે ૧૧:૦૦ વાગ્યાથી ૧૩.૦૦ વાગ્યા સુધી રહેશે. ટેન્ડર અધિકૃત અધિકારીની હાજરીમ

૪. ચડા વાડુ તોટીસમાં જણાવેલ બાકી રકમ પર લોન એગ્રીમેન્ટ મુજબ લાગુ રહેશે અને આકસ્મિક ખર્ચ, કોસ્ટ વગેરે બાકી છે અને તેના છુટકારા સુધી ચુકવવાપાત્ર છે, જેમાંથી કાનુની અને કોઇપણ ચાર્જ

જાહુલ ૧૯૭૦. પ. આથી દેવાદાર અને જામીનદારને વેચાણના સમયે હાજર રહેવા નોટીસ આપવામાં આવે છે અને તેઓ વેચાણની શસ્તો અને નિયમોની વિગતો મુજબ ઉપર જણાવેલ સ્થાવર મિલકતની ખરીદી માટે સ્ યરાવતા ખરીદાર/ગ્રાહકો લાવી શકે છે.

૭. છએમ^{ડી} ગુરગાઁવ ખાતે ચુકવવવાપાત્ર ''આઇઆઇએફએલ હોમ ફાચનાન્સ લીમીટેડ'' ની તરફેણમાં ડીડી મારફત ચુકવવાપાત્ર છે અને સંબંધિત શાખા/કોર્પોરેટ ઓફીસે જમા કરી શકાશે ૮. આથી ઉપર જણાવેલ દેવાદારોને સાત દિવસની અંદર કબજો લેવા સમયે સિક્યોર્ડ મિલકતોમાં રહેલ ઘરેલુ ચીજવસ્તુઓ લઇ જવા સલાહ આપવામાં આવે છ, નહીતર, આઇઆઇએફએલ-એચએફએ

ટ. આથી ઈપર જણાવલ દ્વાદારાને સાત દિવસની અદર કબ્જા લવા સમય સિક્યાડી ાયલકામાં રહેલ ઘરેલું ચીજવસ્તુઓ લઇ જવા સલાહ આપવામાં આવે છ, નહાંતર, આઇઆઇએફએલ-એચએફએલ કોઇણ સંજો એ હેઠળ મિલકતના કોઇપણ નુકશાન માટે જવાબદાર ગણાશે નહી. ૯. આથી નોટીસ આપવામાં આવે છે કે, જો તેઓ ઉપર જણાવેલ ચીજવસ્તુઓ લઇ જવામાં નિષ્ફળ જશે તો તેનું કાયદા હેઠળ વેચાણ કરવામાં આવશે. ૧૦. હાલજી વેચાણની વિગતવાર શરતો અને નિષ્મો નિષત દેનર ફોર્મમાં જણાવેલ છે. ટેન્ડર ફોર્મ ઉપરોક્ત શાખા ઓફીસે ઉપલબ્ધ છે અથવા તમે તે https://www.iifihomeloans.com/properties-for-auction ઉપર પણ જોઇ શકો છો. ૧૧. સ્થાવર મિલકત સૌથી ઉંચા ટેન્ડરને વેચવામાં આવશે. આમં છતાં, નીચે સહી કરનાર જો જરૂર જણાય તો, ઇન્ટર સેકશન બીડીંગની પરવાનગી આપવાનો સંપૂર્ણ હઠ અનામત રાખે છે. ૧૨. અધુરા ટેન્ડરો અથવા છેક્ષી તારીખ પછી મળેલ ટેન્ડરો અમાન્ય ટેન્ડર ગણાયે અને તદઅનુસાર રદ કરવામાં આવશે. ઇએમડી પર કોઇ વ્યાજ ચુકવવામાં આવશે નહી. ૧૩. કંપનીની જાણમાં નહીય તેવી મિલકત પત્ની કોઇપણ જવાળાદારીઓ માટે કંપની આબદાર ગણાયો નહી.

ાધુ વિગતો માટે સંપર્કઃ શ્રી અંશુલ જુનેજા નો ૯૯૨૯૯૯૯૩૦૬, ઇમેઇલઃ anshul.juneja@iifl.com ક્રો**ર્પોરેટ ઓફીસ**ઃ પ્લોટ નં. ૯૮, ફેઝ⊢૪, ઇઘોગ વિહાર, ગુરગાઁવ, હરિયાણા-

સહી/– અધિકૃત અધિકારી, આઇઆઇએફએલ હોમ ફાચનાન્સ લીમીટેડ વત



JAYSYNTH DYESTUFF (INDIA) LIMITED

CIN: L24114MH1985PLC03556 Registered Office: 301, Sumer Kendra, P. B. Marg, Worli, Mumbai - 400 018

Tel No.: 022 4938 4200/4300 • Fax No.: 022 3042 3434 Website: www.jaysynth.com ◆ E-mail Id: jsec@jaysynth.com

NOTICE OF 36[™] ANNUAL GENERAL MEETING INFORMATION ON REMOTE E-VOTING, BOOK CLOSURE AND RECORD DATE

Notice is hereby given that the 36th Annual General Meeting (AGM) of the Members of Jaysynth Dyestuff (India) Limited is scheduled to be held on Friday, 17" September, 2021 at 3.00 p.m. through Video Conferencing/ Other Audio Visual Means (VC/OAVM) to transact the business as set out in the Notice of the 36" AGM.

Electronic copies of the Notice of AGM and Annual Report for the Financial Year ended 31st March, 2021 have been sent via email on 25th August, 2021, to all the Members whose email ids are registered with the Company/Depository Participant(s). The Annual Report along with the Notice of the AGM, are also available on the website of the Company at

Members having Demat Account and who have not yet registered their E-mail Id's for receiving documents in electronic form are requested to register their E-mail Id's either with the Company or with their Depository Participants or the Registrar and Transfer Agent of the Company. Members having shares in physical form may register their E-mail Id's by sending a written request at the Registered Office of the Company or by sending an E-mail to rnt.helpdesk@linkintime.co.in mentioning their folio number. Members are requested to keep their E-mail Id's updated in the Demat Account or with the Company as the case may be. Members holding shares either in physical form or dematerialised form, as on cut-off date i.e. Thursday, 09° September, 2021, can cast their votes electronically on all the businesses set forth in the Notice of the 36° AGM, through remote e-voting facility provided by Central Depository Services (India) Limited (CDSL) or through electronic voting facility during the 36th AGM provided by Link Intime India Private Limited.

Details for remote e-voting facility through CDSL are given herein below.

1. The business as set out in the Notice of 36th AGM can also be transacted by remote e-voting means.

The remote e-voting shall commence on Monday, $13^{\rm th}$ September, 2021 (9.00 a.m. IST). The remote e-voting shall end on Thursday, $16^{\rm th}$ September, 2021 (5.00 p.m. IST). 4. The cut-off date for determining the eligibility to vote by remote e-voting or electronic voting during the 36th AGM

is Thursday, 09th September, 2021. Any person, who acquires shares of the Company and becomes Member of the Company after dispatch of Notice of 36" AGM alongwith Annual Report as on the cut-off date i.e. Friday, 20" August, 2021 but before remote e-voting cut-off date i.e. Thursday, 09" September, 2021 may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com or at instameet@linkintime.co.in. However, if he/she is already registered with CDSL for remote E-voting then he/she can use his/ her existing User ID and password for casting vote. If he/she forgets his/ her password, he/she can reset his/her password by using "Forgot User Details/Password" option available on www.evotingindia.com or contact CDSL at 022-23058738/

022-2305 8542/43 In case of any grievances, queries or issues regarding remote e-voting process, Members may refer the Frequently Asked Questions ("FAQs") and remote e-voting manual available at www.evotingindia.com under help section o may contact Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, Unit No. A-2501, Marathor Futurex, Mafatlal Mills Compound, N.M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400 013, or

write an Email at helpdesk.evoting@cdslindia.com or contact at 022-2305 8738 /022-2305 8542/43.

The remote e-voting shall not be allowed beyond Thursday, 16th September, 2021 (5.00 p.m. IST).

Members who did not cast their votes by way of remote e-voting shall be able to exercise their rights at the 36th AGM by way of electronic voting facility provided by Link Intime India Private Limited during the 36th AGM Members who have cast their votes by remote e-voting may also attend the 36" AGM but shall not be entitled to cast their vote again. A Member whose name appears in the Register of members or in Register of beneficial

owners as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting and electronic voting during 10. The Company has appointed M/s. KDT & Associates, Practicing Company Secretaries to act as a Scrutinizer, to scrutinize the remote e-voting process and electronic voting during the 36th AGM.

Notice is hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read the relevant rules framed thereunder and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Friday, 10th September, 2021 to Friday, 17th September, 2021 (both days inclusive) for the purpose of 36th AGM and payment of dividend on equity shares for the financial year 2020-21. The dividend of ₹0.20 per equity share having face value of ₹1/- each recommended by the Board, if approved, at the 36" AGM shall be paid to those Members whose names are furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited as beneficial owners as or Record Date i.e. Thursday, 09th September, 2021 and to those Members who hold shares in physical form and whose name appears on the Register of Members of the Company as on that date.

For: Jaysynth Dyestuff (India) Limited

Riddhi Manoj Pate Company Secretary and Compliance Office

Registered Office: 301, Sumer Kendra, P. B. Marg, Worli, Mumbai - 400 018

E-Tenders are invited from the interested parties for appointment of Contractor for providing outsourced manpower like Quality Control Assistants, Data Entry Operators Casual Workers, Multi Purpose Helpers, Electricians, Hindi Translators, Stenographers, Drivers, etc. to work in Hyderabad Region comprising of Andhra Pradesh & Telangana States. Complete details are available on www.cewacor.nic.in, www.tenderwizard.in/

SAGARDEEP ALLOYS LIMITED

Kalol Gandhinagar-382721 Email: secretary@sdalloys.com; Website: www.sdalloys.com

રેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવે છે**.**

અમે રોકાણકારોને કંપનીને સંબંધિત કોઇપણ સમાચાર અને/અથવા ખલાસાઓ માટે કક્ત એનએસઇ વેબસાઇટ એટલે કે www.nseindia.com જોવા સલાહ આપીએ ં છીએ. કંપની પાસેથી કોઇપણ માહીતી અને/અથવા સ્પષ્ટતા માટે, રોકાણકારોને કંપનીનો secretary@sdalloys.com ઉપર સંપર્ક કરી શકે છે. For Sagardeep Alloys Limited Satish A. Mehta (Managing Director) DIN: 01958984

Place: Santej (Gujarat) Date: August 24, 2021

DHARANI FINANCE LIMITED
Regd. Office. PGP House, New No.59, Sterling Road, Nungambakkam Change CON No. 10 CON Regd. Office. PGP House, New No.59, Sterling Road, Nungamuskadin, Charles CIN No.: L66191TN1990PLC019152
Tel No.: 91-44-2825 4176, 2825 4609, 2831 1313, 2820 7482 Fax No.: 91-44-2823 2074

NOTICE

31ST ANNUAL GENERAL MEETING (AGM), E-VOTING AND BOOK CLOSURE NOTICE is hereby given that the 31st Annual General Meeting (AGM) of the Company will be held or Monday, the 20th September, 2021 at 11:00 AM (IST), through Video Conferencing (VC) / Othe Audio-Visual Means (OAVM) to transact the business, as set out in the notice of AGM, sent to the members by email.

members by email.

In view of the continuing COVID-19 pandemic, the Ministry of Corporate Affairs (MCA) has vide it circular nos. 14/2020 and 17/2020 dated April 8, 2020 and April 13, 2020. Circular No. 20/2020 dated May 5, 2020 and Circular No. 02/2021 dated January 15, 2021 permitted the holding of the Annue General Meeting (AGM) through VC/OAVM, without the physical presence of the Members at a commo venue. Accordingly, the AGM of the company is also being held through VC to transact the business seguit forth in the Notice of the AGM out forth in the Notice of the AGM.

out forth in the Notice of the AGM. In compliance with above circulars, electronic copies of the notice of the AGM and annual report for the financial year 2020-21 has been sent to all the shareholders whose email addresses are registered with the Company/Depository Participant(s) in the permitted mode on 25th August 2021. The requirements of sending physical copy of the Notice of the 31st AGM and the Annual Report to the Members have been dispensed with vide MCA and SEBI Circular. Shareholders holding shares in dematerialized mode are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants. Shareholders holding shares in physical mode are requested to furnish their email addresses and mobile numbers by clicking the https://investor.cameoindia.com with the Company's Registrar and Share Transfer Agent, Carmeo Corporate Services Limited or email to investorig@emeioindia.com.

Pursuant to Section 108 of the Companies Act 2013 and Rule 20 of the Companies (Management an Administration) Rules, 2014 and Regulation 44 of the SEB (Listing obligations and Disclosur Requirements) Regulations 2015, the Company is providing remote e-Voting facility (remote e-voting) all its members to cast their votes on all resolutions set out in the Notice of AGM. Additionally, the company is providing the facility of voting through e-voting platform provided by CDSL during the AGI. (E-Voting). Detailed procedure for remote e-voting / e-voting is provided in the Notice of AGN

. The cut-off date for the purpose of remote e-voting or at the AGM is 13th September 202°

. The remote e-voting shall commence on 17.09.2021 at 9:00 AM (and shall end on 19.09.2021 at 5:00 M after which e-voting platform shall be disabled by CDSL. . Those members, who shall be present in the AGM through VC/OAVM facility and have not cast the

ote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be ligible to vote through e-voting system during the AGM.

 Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend / participal in the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again. . Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after th otice has been sent electronically by the Company and holds shares s of the cut-off date; may obtai the login ID and password by sending a request to investor@cameoindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting then he/she can use his/her existing user id and password for casting their votes.

Members holding shares in physical mode and who have not updated their e-mail addresses with the Company can obtain Notice of the AGM. Annual Report and/or login details for joining the AGM through VC/OAVM facility including - evoting be sending scanned copy of (a) Copy of the signed request lettle mentioning the folio number, name & address of the Member, (b) Self-attested copy of the PAN card and (c) Self-attested copy of any document (e.g. 2. Aadhar, Driving License, Election Identity Card, Passpor in support of the address of the Member by email to investor@cameoindia.com

in support of the address of the Member by email to investor@cameoindia.com

Members who would like to express their views/ask questions as a speaker at the meeting may
pre-register themselves by sending a request from registered e-mail address mentioning their names,
DP ID, Client ID / Folio Number, PAN and mobile number to secretarial@dharanfinance.com 5 (five)
days prior to meeting. Only those members who have pre-registered themselves as speakers will be
allowed to express their views/ask questions during the AGM. The company reserves the right to restrict
the number of speakers depending on the availability of time for the AGM.

The notice of the 31st AGM and Annual Report for the financial year 2020-2021 will also be made
available on the Company's website at www.dharanfinance.com, stock exchange website at
www.bseindia.com and CDSL's website, at www.evotingindia.com
In case of any queries relating to e-voting, members may refer the Frequently Asked Questions (FAQs)
and e-voting manual available at www.evotingindia.com, under help section or email to
helpdesk-evoting@cdslindia.com. Any grievance relating to e-voting facility, members may contact
Mr.Muralidharan, Manager, Cameo Corporate Services Limited, Subramaniam Building No.1, Club
House Road, Chennai-600002, Tel 044-28460390 or email: investor@camenidia.com
Pursuant to Section 91 of the Companies Act 2013 reads with applicable Rules and Regulations 42 of the Pursuant to Section 91 of the Companies Act 2013 read with applicable Rules and Regulations 42 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015, the Register of Members and

Share Transfer Books of the Company will remain closed from 14th September 2021 to 20th September 2021 (both days inclusive) for annual closing and 31st AGM.

Dr. Palani G Pariasamy Chairman

કેપ્રી ગ્લોબલ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ . **અને કોર્પોરેટ ઓફીસ :** ૫૦૨, ટાવર—એ, પેનિન્સુલા બિઝનેસ પાર્ક, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પટેલ, મુંબઇ-સ**ર્કલ ઓફીસ :** કેપ્રી ગ્લોબલ કેપિટલ લીમીટેડ, બીજો માળ, 3બી પુસા રોડ, રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી–૧૧૦૦૦

માંગણા નોટીસ

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ડ્રોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ (૧) સાથે વંચાતા સિક્યોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ડ્રોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ કેપ્રી ગ્લોબલ હાઉસિંગ કાયનાન્સ લીમીટેડ (સીજાએચએકએલ) ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટક્સન ઓક્ કાચનાબિસચલ એસેટ્સ અને એન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૧૨) હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરીને અધિકૃત અધિકારીએ જણાવેલ એક્ટની કલમ ૧૩ (૨) હેઠળ માંગણા નોટીસ જારી કરી, નીસે જણાવેલ દેવાદારો (રો) ને તેમને જારી કરાયેલ માંગણા નોટીસમાં જણાવેલ સ્કર્મ ચુકવવા જણાવ્યું હતું જે નીચે પણ આપેલ છે. ઉપરોક્ત અનુસંઘાનમાં આથી એક વખત ફરી જણાવેલ દેવાદાર(રો)ને આ નોટીસના પ્રકાશનની તારીખથી ૬૦ દિવસની અંદર અહી નીચે દર્શાવેલ રકમો તેમજ નીચે જણાવેલ તારીખોથી ચુકવણી અને / અથવા વસુવાતની તારીખ સુધી લાગુ ચડત વ્યાજ, જણાવેલ દેવાદારો દ્વારા કરાયેલ અન્ય દસ્તાવેજો/ લખાણો, જો કોઇ હોય તો તેની સાથે વંચાતા જણાવેલ લોન એગ્રીમેન્ટ હેઠળ ચુકવવા પાત્ર રકમો સીજીએસએ ફએલને ચુકવવા જણાવામાં આવે છે. લોનની બાકી વસુલાત માટે સિક્ચોરીટી તરીકે નીચેની મિલકતો સીજીએચએ ફએલને જણાવેલ

ક્રમ નં.	દેવાદાર(રો)/જામીનદાર(રો)/નું નામ	માંગણા નોટીસની તારીખ અને રકમ	(સ્થાવર મિલકત) અને સિક્ચોર્ડ એસેટ્સની વિગત
۹.	(લોન એકાઉન્ટ નંબર : LNCGHJAMHL000001068 જામનગર શાખા) અજ્યસિંહ ઇન્દ્રસિંહ જાડેજા (દેવાદાર) દાર્મદિપસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, સંદ્રબા ઇન્દ્રસિંહ જાડેજા (સહ-દેવાદાર)	१६-०८-२०२ १ ३।. ४३,६,३४३/-	સબ પ્લોટ નં. ૪૦/એચ, રેવન્થુ સર્વે નં. ૯૩ પૈકી, મારૂતિ નગર, પાણીની ટાંકી પાસે, ખંભાળિયા રોક, ગામ સિક્કા, જામનગર, ગુજરાત–3દ્૧૧૪૧ તેમજ તેના પરનું વર્તમાન અને ભાવી બાંધકામ ધરાવતી મિલકતના તમામ ભાગ અને હિરસા. ચતુઃસીમાઃ પુર્વઃ સબ પ્લોટ નં. ૪૦/આઇ, પશ્ચિમઃ સબ પ્લોટ નં. ૪૦/જી, ઉત્તરઃ રેવન્થુ સર્વે નં. ૯૪, દક્ષિણઃ ૧૦.૦૦ મીટર પહોળો રોક.
₹.		૧૬–૦૮–૨૦૨૧ રૂા. ૧૦,૬૪,૧૬ <i>૮</i> /–	બ્લોક– દ એસ, ફ્લેટ નં. ૧૦૪, આગમ ૯૯ રેસીડેન્સી ફેઝ–ર, રેવન્યુ સર્વે નં. ૧૦૧૭/એ, સચાણા ટાઉ, સાણંદ, વિરમગામ હાઇવે, મોજે સચાણા, તાલુકો–વિરમગામ, અમદાવાદ, ગુજરાત–૩૮૨૧૫૦ તેમજ તેના પરનું વર્તમાન અને ભાવી બાંધકામ ધરાવતી મિલકતના તમામ ભાગ અને હિસ્સા.
3.	(લોન એકાઉન્ટ નંબર : LNHLBRH000025485 ભરૂચ શાખા) ગોપીચંદ પ્રજાપતી (દેવાદાર) મમતાદેવી ગોપીચંદ પ્રજાપતી (સહ–દેવાદાર)	૧૬–૦૮–૨૦૨૧ રૂા. ૫,૦૬,૬૮૩/–	જિલો ભરૂચ પેટા જિલો– અંકલેશ્વર મોજે સંજલી રેવન્થુ સર્વે નં. ૧૨૨, ૧૯૨, ૧૨૮, ૧૨૩, ૧૨૩/૧ થી ૪, ૨૯૬ એ ૧૨૪ પૈકી સનંજલી પ્રઆઇકોસી, જમીન લુગર કો. ઓપ.સોસાચટી લીમીટેક, પ્લેટ નં. ચુ/૧/ળી પૈકી સોસાચટી પાવા મુજબ પતીટ નં. ૮૧ થી ૮૫ પૈકી રઘુવીર રેસીડેન્સી પાર્ટ-૧ પૈકી આઉન્ડ ફ્લોર, ફ્લેટ નં. છુ–૪, બિલ્ટ અપ એરિચા, ક્ષેત્રફળ ૧૮.૬૨ ચો.મી., અને જમીનનોન વહેચાચેલ હિસ્સો, ક્ષેત્રફળ ૭.૧૮ ચો.મી., તેમજ તેના પરનું વર્તમાન અને ભાવી બાંધકામ દારાવતી મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમાઃ પુર્વઃ ફ્લેટ નં. જી૩, પશ્ચિમઃ ફ્લેટ નં. જી૫, ઉત્તરઃ ફ્લેટ નં. જી૧૩, દક્ષિણઃ રોડ
۲.	(લોન એકાઉન્ટ નંબર : LNHLGND000029777 ગાંઘીદ્યામ શાખા) ઇશ્વરભાઇ મગનભાઇ રબારી (દેવાદાર) દરખીબન ઇશ્વર રબારી, અર્જુનભાઇ દેવાભાઇ રબારી (રહ-દેવાદાર)	૧૬–૦૮–૨૦૨૧ રૂા. ૧,૯૧,૭૬૪/–	પ્લોટ નં. ૫૬, (એરિચા ક્ષેત્રફળ ૧૧૧.૫૬ ચો.મી., પ્લોટ નં. ૫૭, રેવન્થુ સર્વે નં. ૧૧૨/૧, ગામ લાખાપુર, તાલુકો– અંજાર, કચ્છ, ગુજરાત– ૩૩૦૧૧૦, તેમજ તેના પરનું વર્તમાન અને ભાવી બાંધકામ ધરાવતી મિલકતાના તમામ ભાગ અને હિસ્સા. પૂર્વ: પ્લોટ નં. ૧૧ અને ૬૨, પશ્ચિમ: અંદરનો રોડ, ઉત્તર: પ્લોટ નં. ૫૮, દક્ષિણ: પ્લોટ નં. ૫૫.
u.	(લોન એકાઉન્ટ નંબર : LNHLPAL00004511 પાલનપુર શાખા) જીતેન્દ્રકુમાર મગનલાલ રાઠોડ (દેવાદાર) વિકાસ જીતેન્દ્રભાઇ રાઠોડ, મંજુલાબેન જીતેન્દ્રભાઇ દરજી (સહ-દેવાદાર)	૧૬–૦૮–૨૦૨૧ રૂા. ઝ ,૩૨,૯૪૩/–	રેવન્થુ સર્વે નં. ૫/૧નો રેસીડેન્સીચલ પ્લોટ, પ્લોટ નં. ૧૦૧, (એરિચા ક્ષેત્રફળ ૫૫. દૃદ્દ ચો.મી.) ભોચણ, ગુરૂ ગ્રીન રેસીડેન્સી, ગોરી સદન રેસીડેન્સી સામે, તાલુકો– ડીસા, જિલો–બનાસકાંઠા, ગુજરાત– ૩૮૫૫૩૫ તેમજ તેના પરનું વર્તમાન અને ભાવી બાંદાકામના તમામ ભાગ અને હિરસા. પુર્વ: ૦૬ મીટર પહોળો રોડ, પશ્ચિમ: કોમન પ્લોટ, ઉત્તર: પ્લોટ નં. ૧૦૨, દક્ષિણ: પ્લોટ નં. ૧૦૦
ξ.	(લોન એકાઉન્ટ નંબર : LNHLSUR000017732 સુરત શાખા) કૌશલ કિશોર પ્રસાદ (દેવાદાર) રાધા દેવી (સહ–દેવાદાર)	૧૬-૦૮-૨૦૨૧ ગ્રા. ૭, ૭૪,૩૩૨/-	ફલેટ નં. ૨૦૪, બીજો માળ, બિલ્કીંગ નં૮, શ્રી તિરૂપતિ બાલાજી રેસીકેન્સી, મુકામ : સાંકી, બ્લોક નં.૭૨/બી પૈકી એ ટાઇપ પ્લોટનં. ૧૯ અને બી ટાઇપ, પ્લોટ નં. ૧૮, ગામ: સાંકી, તાલુકો: પલસાણા, િ જક્ષો–સુરત, ગુજરાત–૩૯૪૩૧૦ ક્ષેત્રફળ અંદાજી ૨૯.૦૮ ચો.મી. (બિલ્ટ અપ એરિયા) તેમજ જણાવેલ જમીનમાં ન વહેચાચેલ હિસ્સો તેમજ તેના પરનું વર્તમાન અને ભાવી બાંધકામ ધરાવતી મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા:પુર્વ: બિલ્કીંગ નં. ૦૯, પશ્ચિમ: રોડ, ઉત્તર: જમીન, દક્ષિણ: બિલ્કીંગ નં. ૭
9.	(લોન એકાઉન્ટ નંબર : LNHLBRH000034666 ભરૂચ શાખા) નરેશકુમાર અશુલાલ વિશ્વકર્મા (દેવાદાર) દીલસારી વિશ્વકર્મા, ચસ બહાદુર સુનાર (સહ-દેવાદાર)	૧૬-૦૮-૨૦૨૧ રૂા. ૫,૦૬,૩૪૩/-	ફલેટ નં.: એફ–૭, પહેલો માળ, (ગ્લેઝફળ ૧૮.દ્ ચો.મી.) રઘુવીર રેસીડેન્સી–૨, અંકલેશ્વર, સંજલી ભરૂચ, રેવન્થુ સર્વે નં. ૧૨૨, ૧૯૨, ૧૨૮, ૧૨૩/૧ થી ૪, ૨૯૬ અને ૧૨૪ પૈકી સંજલી જીઆઇડીસી જમીન લુઝર કો.ઓપ.સોસાચટી લીમોટેડ પ્લોટ નં. ચુ/૧/બી પૈકી, સોસાચટી પ્લાન મુજબ, પ્લોટનં. ૧૪૫ થી ૧૪૯ પૈકી, ગુજરાત- ૩૯૪૧૨૬, તેમજ તેના પરનું વર્તમાન અને ભાવી બાંધકામ ધરાવતી મિલકતના તમામ ભાગ અને હિસ્સા. પૂર્વ: ફલેટ નં. એફ૬, પશ્ચિમ: ફલેટ નં. એફ૮, ઉત્તર: રોડ, દક્ષિણ: ફલેટ નં. એફ૧૦
٤.	(લોન એકાઉન્ટ નંબર : LNHLSUR000039622 સુરત શાખા) ઓમપ્રકાશ જગજ્ઞાથ ચાદવ (દેવાદાર) સરોજ ઓમ પ્રકાશ ચાદવ (સહ–દેવાદાર)	૧૬–૦૮–૨૦૨૧ રૂા. ૫૬૪૩૫૬/–	ફલેટનં. ૨૦૯, બીજો માળ, ક્ષેત્રફળ ૪૨૦ ચો.ફુટ ૩૯.૦૩ ચો.મી., સુપર બિલ્ટ અપ એરિચા અને ૨૬૬.૧૩ ચો.ફુટ એટલે કે ૨૪.૭૩ ચો.મી., બિલ્ટ અપ એરિચા, તેમજ દારા પેલેસના વિંગ બીમાં ન વહેચાચેલ હિસ્સો, પ્લોટ નં.૪૯, ૫૦,૫૧,૫૨,૫૩,૫૪, કુલ ક્ષેત્રફળ ૪૮૯.૨૪ ચો.મી. પારેખ એસ્ટ્રેટના. રેવલ્થ સર્વે નં ૧૯૨–સે. ૧૯૩

અભિલાષા આર્કેડ, દક્ષિણ: રોડ જો જણાવેલ દેવાદારો સીજાએચએકએલને ઉપરોક્ત રકમ ચુકવવામાં નિષ્કળ જશે તો, સીજાસીએલ એક્ટની કલમ ૧૩(૪) અને લાગુ નિચમો ફેઠળ ઉપરોક્ત સિક્ચોર્ડ એસેટો સામે કાર્યવાહી કરશે, જેસપુર્ધપણે જણાવેલ દેવાદારોના ખર્ચ અને પરિણામોના જોખમે રહેશે. જણાવેલ દેવાદારોને એક્ટ હેઠળ સીજીએચએક્એલની આગોતરી લેખીત મંજુરી વગર, સદરહું એસેટોની વેચાણ, ભાડે અથવા અન્ય રીતે તબદીલ કરવાની મનાઇ ફરમાવામાં આવે છે. જણાવેલ એક્ટ અને તે હેઠળ રચાયેલ નિયમોની જોગવાઇઓનો ભંગ અથવા ઉલંદાન કરનાર અથવા તેમાં સહાય કરનાર કોઇપણ વ્યક્તિ એક્ટ હેઠળ જણાવેલ જેલ અને/અથવા દંડને પાત્ર બનુશે.

સહી/– અદિાકૃત અદિાકારી કેપ્રી ગ્લોબલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ. સ્થળ : ગુજરાત તારીખ : ૨૫.૦૮.૨૦૨૧



વિક્રમભાઇ મકવાણા

人 વાસ્તુ હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ VASTU યુનિટ ૨૦૩ અને ૨૦૪, બીજો માળ, "એ" વિંગ, નવભારત એસ્ટેટ, ઝકારિયા બંદેર ગેલ એતર્ચ (પાઉમા) પ્રંતના ઝકારિયા બુંદેર રોડ, સેવરી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૧૫. મહારાષ્ટ્ર. CIN No. U65922MH2005PLC272501

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

જત જણાવવાનું કે **વાસ્તુ હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડ** ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઇઝેશન અને રીકન્સ્ટક્શન ઓક કાયનાન્સિયલ એસેટસ અને એન્કોર્સમેન્ટ ઓક સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ હેઠળ અને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફ્રોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૯ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને, તારીખ ૧૨મે, ૨૦૨૧ ના રોજ માંગણા નોટીસ જારી કરીને દેવાદાર શ્રી <mark>મેહુલભાઇ શંભુભાઇ મકવાણા (અરજદાર), અને શ્રી શંભુભાઇ સોમાભાઇ મકવાણા (સહ-</mark> **અરજદાર), શ્રીમતી મુક્તીબેન મેહુલભાઇ મકવાણા (સહ-અરજદાર)** ને સંદરહું નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર નોટીસમાં જણાવેલ ૨કમ **રૂા. ૫૧૧૮૬૮/-(રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર આઠસો અડસઠ પુરા)** ચુકવવા જણાવ્યું હતું.

દેવાદારો રકમ ચુકવવામાં નિષ્ફળ રહ્યા હતા, પરિણામે દેવાદારો, જામીનદારો અને જાહેર જનતાને અહીં નોટીસ પાઠવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ નિયમોના નિયમ ૯ સાથે વંચાતી જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતો સાંકેતિક કબજો **૨૪ ઓગસ્ટ, ૨૦૨૧** ના

પરિણામે ખાસ કરીને દેવાદારો, જામીનદાર અને જાહેર જનતાને નીચે જણાવેલ મિલકત સાથે કોઇપણ જાતનો વ્યવહાર ન કરવા માટે સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ વ્યવહાર **વાસ્ત હાઉસિંગ કાયનાન્સ** કોર્પોરેશન લીમીટેડ(અમદાવાદશાખા)ની રકમ રૂા. પ૧૧૮૬૮/-(રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર આઠસો **અડસઠ પુરા)** મુજબ અને તેના પરના વ્યાજ, ખર્ચ વગેરેને આધિન રહેશે

સ્થાવર મિલકતોની વિગત

શ્રી શંભુભાઇ સોમાભાઇ મકવાણાની મિલકત નં. ૭૪૫, મકવાણા વાસ, બળિયા દેવ મંદિર પાસે, જવાલ ગામ રોડ, જુવાલ એરિયા, બાવળા, જુવાલ, સાણંદ, સાણંદ, અમદાવાદ, ગુજરાત ૭૮૨૨૨૦ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા ઉત્તરઃ સોસાયટીનો રોડ, દક્ષિણઃ સોસાયટીનો રોડ, પુર્વઃ જેઠાભાઇ તભાભાઇ મકવાણા, પશ્ચિમઃ અમરતભાઇ

તારીખ : ૨૬.૦૮.૨૦૨૧ અદ્યિકૃત અદ્યિકારી વાસ્તુ હાઉસિંગ ફાચનાન્સ કોર્પોરેશન લીમીટેડ

જાહેર નોટીસ આથી નોટીસ આપવામાં આવે છે કે **સીટી સર્વે નં. ૭૨૧** ગામ પંચાયત નં. ૨૩૩૯, ધનસુરા, જિલો અરવણી

આના પશાસન જ . 33 દ, વળતુરા, 17થા ઇન્ટરાશા-ગુજરાત (ક્ષેત્રકૂળ એરિયા ૧૪૦ એ. કેટ્ર, 9 ખાતેની માંગ્રે મિલકતના દસ્તાવેજો એટલે કે સેલ ડીડ ન. પગ્ર તારીખ ૧૧.૦૧. ૨૦૨૩, શારદાએન એ પટેલ અને અન્ય દ્વારા નિર્મેલ કુમાર વી પટેલ અને દ્વા વી પટેલની તરફેશમાં કરાયેલ તેમજ આર.આર. અને ઇન્ડેક્સ ર ગુમ શચેલ છે. જો મળે તો **આવાશ ફાયનાન્સીયર્સ લીમીટેક,** ૨૦૧, ૨૦૨, બીજો માળ, સાઉથન સ્કવેર, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જ્યપુર ખાતે જાણ કરવા વિનંતી છે. **- વિક્રમભાઇ રાજીવભાઇ ખંત**

૪૮૯.૨૪ રો.મી, પારેખ એસ્ટેટના, રેવન્યુ સર્વે નં. ૧૯૨-એ, ૧૯૩,

૧૯૦, ૧૯૬, ૧૯૭, ૧૯૨–બી, બ્લોક નં. ૧૨૨, ગામઃ તાંતીથેયા

તાલુકો– પલસાણા, જિલો– સુરત, ગુજરાત–૩૯૪૩૧૫, તેમજ તેના

પરનું વર્તમાન અને ભાવી બાંદ્યકામની મિલકતના તમામ ભાગ અને

હિસ્સા. ચતુઃસીમાઃ પુર્વઃ રોડ, પશ્ચિમઃ બિલ્ડીંગ, ઉત્તરઃ બિલ્ડીંગ

punjab national bank સર્કલ સસ્ત્ર ઓફિસ રાજકોટ - (830400) Email :- cs8304@pnb.co.in

સુધારો આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે નીચે આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે નીરે ઇક્ટાઇ કરાનેર તા. ૧૮. ૦૮. ૧૦૨૧ ના રોજ જાહેર છે. ૧૯૧૭ નીટિસ દૈનિક અખનાર ''ફાશનાન્સિયલ એક્સપ્રેસ (ગુજરાતી)- ગુજરાત આવૃતિ' માં પ્રકાશિત કરાવેલ જેમાં, ''ઈ-હરાજીની તારીખ: ૦૪-૦૯-૧૦૨૧ અને ''ઈએમડી અને બીડ ડોક્યુમેન્ટ જમા કરાવવાની છેલી તારીખ: ૦૩. ૦૯. ૨૦૨૧ રાખેત હતી જે કેટલાક ટેકનીકલ ઇસ્ચુના કારણે ''ઈ-હરાજીની તારીખ: ૦૭-૦૯-૨૦૨૧ અને ''ઈએમડી અને બીડ ડોક્યુમેન્ટ જમા કરાવવાની છેલી તારીખ: ૦૫. ૦૯. ૨૦૨૧ એમ સાથેલ છે. બાકીની તમામ વિગતો નીટિસમાં જણાવ્યા મુજબ ચથાવત રહેશે. જેની નોંધ લેવી.

તારીખ : ૨૫-૦૮-૨૦૨૧ સહી/- અધિકૃત અધિકારી

सेन्ट्रल બेंક ऑाइ ઇन्ડिया Central Bank of India

ક્ષેત્રીય કાર્યાલય - ગાંધીનગર, લાલ દરવાજા, અમદાવાદ - ૩૮૦૦૦૧

પરિશિષ્ટ - ૪ (નિયમ-૮(૧)) **કબજા નોટીસ** (સ્થાવર મિલકત માટે) નાથી, નીચે સહી કરનાર **સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ગાંધીનગર શાખા, જીક્ષો - ગાંધીનગર**્નન આથી, નીચે સહી કરનાર સેન્દ્રલ બેંક એક ઇન્ડિયા, ગાંધીનગર શાખા, જીકો - ગાંધીનગર ના અધિકૃત અધિકારીને સિક્ચોરિટાઇઝેશન એન્ડ રીકેસ્ટ્રકશન ઑફ કાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ડિસેન્ટ ઓન્ડ એન્ડિસેન્ટ ઓન્ડ સેમ્બેટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને કલમ ૧૩(૧૨) દેકળ મળેલ સત્તા સાથે સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્કોસેમેન્ટ) ના નિચમ, ૨૦૦૨ સાથે વંચાતા નિચમ ૩ અંતર્ગત તા. ૦૨.૦૪.૨૦૨૧ ના રોજ જારી કરેલ ડિમાન્ડ નીટીસ ક્ષારા કરજદાર મેમર્સ મધર ઇનસ્ટીટયુર ઑફ ઇલેક્ટ્રીનિક ટેકનોલોજી (કરજદાર અને ગીરોદાર), શ્રીમતી સોનલ અપુર્વાભાઈ શેક (જમીનદાર અને ગીરોદાર), શ્રીમતી સોનલ અપુર્વાભાઈ શેક (જમીનદાર અને ગીરોદાર), શ્રીમતી સોનલ અપુર્વાભાઈ શેક (જમીનદાર અને ગીરોદાર તેમના ક્ષારા POAH શ્રી અપુર્વ સુરેશભાઈ શેક) ને નીટીસમાં જણાવેલી રકમ રૂા. ૧,૦૮,૧૬,૧૯૦/- (શબ્દોમાં રૂપિયા એક કરોડ આઠ લાખ સોળ હજાર એક્સો નેવું માત્ર) સાથે નીટીસમાં જણાવેલ વ્યાજ સાથે સદર નીટીસ મળ્યા ત્રીખથી ૧૦ દિવસમાં ચલવવા જણાવવામાં આવશ તતે

એકિ લાખ લાખ કરાવ અંત્રલા અનુ નાગું હતા અનાવા મુખ્યત્વે હતા. તારીખર્થી ૧૦ દિવસમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. કરજદાર આ રકમ ચુકવવામાં અસફળ રહ્યા હતા જેથી કરજદાર અને જાહેર જનતાને નોટિસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્ચોરિટી ઈન્ટરેસ્ટ એન્ફ્રીસમેન્ટ નિયમ ૨૦૦૨ ના કાચારી કલમ ૧૩ની પેટા કલમ (૪) સાથે વાંચતા નિચમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ **તા. ૨૧.૦૮.૨૦૨૧** ના રો૧ નીચે જણાવેલ મિલકતનો **સાંકેતિક કબજો** લઈ લીધેલ છે.

આથી કરજદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે નીચે દર્શાવેલ મિલકત માટે કોઇ પણ વ્યવહાર કરવો નહિં અને જો કોઈ પણ વ્યવહાર કરશો તો **સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા**ની બાકી રકમ **રૂા.** ૧.૦૮.૧૬.૧૯૦/- (શબ્દોમાં રૂપિયા એક કરોડ આઠ લાખ સોળ હજાર એકસો નેવં માત્ર) અને તા 1,005, 13, 1609, (સંવર્ધના સુધવા અંક કરાંક આઠ લાખ સાંગ ફુ કાર એક્સા મધુ નાત્ર) અંગ લા 00.03.૨0૨૧ થી વ્યાજ + અન્ય ખર્ચા સાથે બોજાને આધિન રહેશે. (કલમ ૧૩(૨) મુજબ ડિમાન્ડ નોટિર આપ્યા પછીની જમા રકમ બાદ કરીને)

સદરહુ કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે કરજદારનું મુકરર મિલકત છોડાવવ માટે મળવાપાત્ર સમગ્ર બાબતે દેશાન દોરવામાં આવે છે.'

સ્થાવર મિલકતનું વર્ણન

. ઈક્વિટેબલ ગીરો મિલકત જે મેસર્સ મધર ઈનસ્ટીટચુટ ઑફ ઈલેક્ટ્રોનિક ટેકનોલોજી પ્રોપરાઈટરી કન્સર્ન શ્રી અપૂર્વા સુરેશભાઈ શેઠ ની માલીકી ની અચલિત મિલકતના બઘા ભાગ અને હિસ્સા સાથે કોમર્શીચલ ઓફિસ નં. - ૪૩, ચોથો માળ, નોર્થ વ્યુ કો. ઓપ. હાઉસીંગ સોસાચટી લિમિટેડ, ''શેલીન કોમ્પ્લેક્ષ'' નામે જાણીતી, સર્વે નં. ૨૭૯ / પી, ફાઈનલ પ્લોટ / હિસ્સા નં. ૦૧ / બી /પી, ટી.પી. સ્ક્રીમ નં.-૨૨, ગામ સીમા મોજે - પાલડી, તાલુકા સીટી, રજીસ્ટ્રેશન જીલો અને સબ જીલો -અમદાવાદ સદર સ્કીમ ના ઈમ્પોર્ટેબલ પ્રમાણસર શેર ક્ષેત્રફળ બી.યુ. એરિયા 😑 ૧૫૮૦ સ્કે. કુટ એટલે ૧૪७ સ્કે. મીટર્સ અને ચતુરસીમા આ મુજબ છેઃ પૂર્વઃ યુનિટ / ઓફિસ નં. ૪૨, પશ્ચિમઃ અંદરનો રોડ, ઉત્તરઃ સોસાયટી માર્જીન જગ્યા અને પછી રોડ, દક્ષિણઃ સબ પ્લોટ નં. ૦૨.

. ઈક્વિટેબલ ગીરો મિલકત જે શ્રી અપુર્વા સુરેશભાઈ શેઠ અને શ્રીમતી સોનલ અપુર્વાભાઈ શેઠની માલીકી ની અચલિત મિલકતના બધા ભાગ અને ફિસ્સા સાથે કોમર્શીયલ ઓફિસ નં. - ૪૦૩, ચોથો માળ. ''એલીગ્નમ આર્ફેડ'' નામે જાણીતી. બાંધકામ જમીન એચ કે (મણીનગર) ઓનર્સ એસોશીએશન, સીટી સર્વે નં. ૫૩૩૮ પૈકી, હિસ્સા નં. ૫/૧/૩ પૈકી, કાઈનલ પ્લોટ નં. ૧૨૫ પૈકી, ટી.પી. સ્કીમ નં. - ૪ (મણીનગર) મોજેઃ ખોખરા - મેમદાવાદ, તાલુકા - સીટી, રજીસ્ટ્રેશન જીલો અમદાવાદ અને સબ - જીલો અમદાવાદ - ૫ (નારોલ), સદર સ્ક્રીમના પ્રમાણસરના શેર ક્ષેત્રફળ સુપર બિલ્ટ અપ એરિયા = ૩૩૫૦ સ્કે. કુટ એટલે ૩૧૧.૨૨ સ્કે. મીટર્સ અને ચતુરસીમા આ મુજબ છે: પર્વઃ માર્જાન પછી જોડાયેલ મિલકત, પશ્ચિમઃ માર્જાન અને પછી અંદરનો રોડ, ઉત્તરઃ માર્જાન અને પછી અંદરનો રોડ, દક્ષિણ: પેસેજ, સીડી અને લીફ્ટનો ભાગ પછી ઓફિસ નં. ૪૦૧, ૪૦૨.

તારીખ : ૨૧.૦૮.૨૦૨૧ સ્થળ : ગાંધીનગર

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

જત જણાવવાનું કે **એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ**ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ઠેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિચમો ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ જેણાવેલ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ જારી કરીને નીચેના દેવાદારોને જણાવેલ નોટીસમાં જણાવ્ય અનુસાર તેમના નામ સામે જૂણાવેલ રકમ લાગુ દરોએ તેના પરના વ્યાજ સહિત ચુકવણીની અને/અથવા વસુવાત સુધીનો તારીખ સુધી લાગુ, આકરિમક ખર્ચ, બોજા, ચાર્જ વગેરે સહિત જ્યાવેલ નોટીસોની મળ્યાની તારીખથી દૃ૦ દિવસની અંદર ચુકવી જ્વા માટે જ્યાવ્યું હતું.

		- 5-	- 3-3			
મ i.	લોન એકાઉન્ટ નં. / વેચાણ બેંકનું નામ/ દેવાદારનું નામ	કુલ બાકી રકમ (રૂા.માં) છેલી તારીખ	કબજાનો પ્રકાર અને તારીખ			
9	શ્રી દિપક ગણેશભાઇ કહાર/શ્રીમતી લતાબેન જી કહાર/શ્રી પરેશ કુમાર શાહ/૧૦૩૮૮૨૧૭૯/ભારતીચ સ્ટેટ બેંક	૦૬ ઓક્ટોબર, ૨૦૧૫ નાં રોજ રૂા. ૪,૦૬,૦૭૫.૭૨/–	૨૧.૦૮.૨૦૨૧ સાંકેતિક			
ù	3553) 4 (355 1, 502 4, 60202 20) 1100 2102 20 4 (1,12) 2100 20 20 20 20 20 20 20 20 20 20 20 20 2					

ાસક્યાડ ામલકત: ફ્લટ ન. ડા/૩૦૨, ૩જા માળ, ટાવર અન ડા પરાગરાજ સાસાયટા, હરણા– વરાસીયા રીંગ રોડ, વડોદરા, સર્વે નં. ૨૪૫, ટાઉન પ્લાનિંગ નં. ૫, ફાઇનલ પ્લોટ નં. ૧૭૨, ગામ સાવેદ, જિલો–વડોદરા–૩૯૧૧૧૦, ગુજરાત. ર શ્રી ૨મેશ શંક૨ભાઇ ભાટીયા/શ્રીમતી વસંતી ૧૨ મે, ૨૦૨૧ નાં રોજ 9505.20.99 રમેશ ભાટીચા / LBBRD00000354349 / આઇસીઆઇસીઆઇ બેંક લીમીટેડ રૂા. ૩,૭૮,૧૯૭.૬૬/-સાંકેતિક સિક્યોર્ડ મિલકતઃ શીવ નગર સોસાયટી ૧૪, ગાંધી પાર્ક પાસે, માનેજા, વડોદરા-૩૯૦૦૦૨,

શ્રી સમીરભાઇ લક્ષ્મણરાવ દુર્વે/શ્રીમતી ०६ जून, २०१८ 99.06.2029 શિથલ લક્ષ્મણરાવ દૅર્વે સાંકેતિક નાં રોજ BRDHL16000315 / BRDHL16000316 રા. ૯૪,૦૭,૦૬૨.૨૨/-એલ એન્ડ ટી કાયનાન્સિયલ સર્વિસીઝ સિક્યોર્ડ મિલકતઃ ફ્લેટ્ર નૃં. એ–૫૦૨, પાંચમો માળ, (લોઅર અપ૨), ક્રીસ્ટલ વ્હાઇટ, નિલમબાર

પાછળષ વાસણા ભાચલી રોડ, વડોદરા, ગુજરાત. 🗴 શ્રી મેહુલભાઇ જી પરમાર/શ્રીમતી કાજલબેન ૧૬ માર્ચ, ૨૦૧૯ 9505.30.89 મેહુલકુમાર પરમાર / ભૌતિક નાં રોજ ક્03૮૦૭૨૧૦૨૨૩૬૫૯ / ફુલર્ટન ઇન્ડિયા હોમ ફાયનાન્સ કંપની લીમીટેડ રૂા. ૧૪,૨૪,૭૭૦.૫૭/– સિક્યોર્ડ મિલકત: રાજકોટ ટેવન્યુ સર્વે નં. ૨૪૯ પૈકી, સીટી સર્વે વોર્ડ નં. ૧૧, ટાઉન પ્લાનિંગ નં.

દ્દ, ફાઇનલ પ્લોટ નં. ૧૫૫ પૈકી, હુંડકો ક્લાટર નં. સી-૫૪, હુંડકો બસ સ્ટેશન પાસે, ફાયર બ્રિગેડ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ-૩૬૦૦૦૨, ગુજરાત. જત જણાવવાનું કે અહીં ઉપર જણાવેલ દેવાદારો બાકી લેણાંની રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાર્થ ખાસ કરીને ઉપર જણાવેલ દેવાદારો અને જાહેર જ્જાતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે **આર્સિલ**ના અધિકૃત અધિકારીએ ઉપર જણાવેલ તારીખોએ જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) ને જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વાંચન હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ ઉપર જણાવેલ મિલકતો/ સિક્ચોર્ડ એસેટોનો **સાંકેતિક / ભીતિક કબજો**

ખાસ કરીને અહીં ઉપર જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને ઉપર જણાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટો સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જણાવેલ મિલકતો/સિક્ચોર્ડ એસેટો સાથે કોઇપણ સોદો આરિલના ચાર્જને આદ્યિન રહેશે. સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયમર્યાદા અંગે કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ને

... જોગવાઇઓ પ્રત્યે દેવાદારો/મોર્ગેજરો/જામીનદારોનું ધ્યાન દોરવામાં આવે છે. સહી/– અદ્યક્ત અદ્યકારી ક્શળ : ગઢકાવ

એસેટ રિકન્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ તારીખ : ૨૬.૦૮.૨૦૨૧ ચિત્રાં એસેટ રિકન્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ. CIN: U65999MH2002PLC134884 www.arcil.co.in રજીસ્ટર્ડ ઓફીસ : દારૂબી, ૧૦મો માળ, ૨૯ સેનાપતી બાપટ માર્ગ, દાદર (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૨૮, ફોન

+६१ २२ ६६५८९३०

શાખા ઓકીસ : દ૧૦, દક્ષે માળ, સન સ્કવેર બિલ્ડીંગ, હોટેલ રિગેન્ટા અંતરિમ પાસે, આઇડીએક્સી બેંક આગળ, સી.જી. રોડ પડખે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૬, ગુજરાત. **ફોન** : ૦૭૯–૪૦૩૦૬૩૦૧/૦૧

Sagar Deep સાગરદીપ એલોચસ લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : પ્લોટ નં.૨૦૭૦, રાજનગર પાટીયા, સાંતેજ–ખાત્રજ રોડ, સાંતેજ, કલોલ, ગાંધીનગર–૩૮૨૭૨૧ ઇમેઇલ : <u>secretary@sdalloys.com</u> વેબસાઇટ : <u>www.sdalloys.com</u> ૧૪ મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ, ઇ–વોટીંગ માહિતી અને બુકક્લોઝર

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ચૌદમી વાર્ષિક સામાન્ય સભા શક્રવાર. ૧૭ સપ્ટેમ્બર. ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી) અથવા અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વાર એજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે. નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧નો વાર્ષિક અહેવાલ . એન્યુઅલ રીપોર્ટ) તેમજ એજીએમની નોટીસ એમસીએ પરિપત્ર નં. ૨૦/૨૦૨૦તા. પ મે,૨૦૨૦સાથે વંચાતા સામાન પરિષત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને ૦૨/૨૦૨૧ અનુક્રમે તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ (સંયુક્ત રીતે એમસીએ પરિપત્રો તરીકે દર્શાવેલ છે) અને પરિપત્ર નં. - તારીખ ૧૨ મે ૨૦૨૦ અને - તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ (સંયુક્ત રીતે જણાવેલ સેબી પરિપત્રો તરીકે દર્શાવેલ છે મુજબ ફક્ત ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જે શેરહોલ્ડરોના ઇમેઇલ એડ્રેસો કંપની / ડિપોજીટરી પાર્ટીશીપન્ટ પાસે રજીસ્ટર્ડ છે તેમને મંગળવાર ર૪ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ મોકલેલ છે. તે કંપનીની વેબસાઇટ એટલે કે https://www.sdalloys.com/download4.php?filename=Annual%20Report%202020-2021.pdf

કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૦૮ સાથે વંચાતા કંપનીઓ (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ સુધારા મુજબ કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન)નિયમો, ૨૦૧૫ ના નિયમ ૨૦ અને લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વયારમેન્ટ્સ નિયમનો, ૨૦૧૫ (એલઓડીઆર)ના નિયમન ૪૪ અંતર્ગત સભ્યોને સીડીએસએલ દ્વારા પુરી ૫ડાયેલ એજીએમના સ્થાન સિવાય અન્ય સ્થળે થી ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિ (રીમોટ ઇ-વોટીંગ)નો ઉપોયગ કરીને એજીએમી નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર તેમના મત આપવા માટેની સવલત આપવામાં આવેલ છે અને આવા મતદાન મારફત કાર્યો પાર પાડવામાં આવશે.

ડ-વોટીંગનો સમયગાળો મંગળવાર, ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ (સવારે ૯.૦૦ વાગ્યે) શરૂ થશે અને ગુરૂવારર ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ (સાંજે ૫.૦૦ વાગ્યે) પુર્ણ થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો ઇલેક્ટ્રોનિકલી . !મના મત આપી શકે છે. ત્યાર બાદે ઇ-વોટીંગ મોડ્યુલ સીડીએસએલ દ્વારા બંધ કરવામાં આવશે. ઠરાવ ઉપર એક વખત

યત આપ્યા પછી, ત્યારબાદ તેમા ફેરફાર કરવાની પરવાનગી મળશે નહી. બેજીએમમાં ઇ-વોટીંગ માટેની પ્રક્રિયા રીમોટ ઇ-વોટીંગની પ્રક્રિયાની જેવી જ છે. ફક્ત વીસી/ઓએવીએમ સવલત મારફત બેજીએમમાં હાજર રહેનાર શેરહોલ્ડરો અને જેમણે એજીએમ પહેલા રીમોટ ઇ-વોટીંગ <mark>દ્વારા એ</mark>જીએમની નોટીસમાં ૪ણાવેલ ઠરાવો પર તેમના મત આપ્યા નથી અને જેઓ તેમ કરવા પ્રતિબંધિત નથી તેઓ એજીએમમાં ઇ-વોટીંગ પદ્ધતિથી યત આપવા હકદાર ગણાશે અને તેમની હાજરી કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે, આમ છતાં આવા શેરહોલ્ડરો આવા ઠરાવ(વો) પર એજીએમમાં ફરી તેમના મત આપવા માટે હકદાર ગણાશે નહી જેમણે રીમોટ ઇ-વોર્ટીંગથી

ાભ્યોના મતદાન હકો૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ (કટ–ઓફ તારીખ)ના રોજ કંપનીની ભરપાઇ થયેલ ઇક્વીટી શેર મુડીમાં તેમની પાસે રહેલ ઇક્વીટી શેરોના હિસ્સાને અનુરૂપ રહેશે. કટ ઓફ તારીખ ના રોજ કંપનીની સભ્યો હોય તેવી કોઇપણ વ્યક્તિ રીમોટ ઇ-વોટીંગ અથવા એજીએમમાં વોટીંગનો ઉપયોગ કરીને એજીએમની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર

યત આપવા માટે હકદાર છે.

મેજીએમની નોટીસની રવાનગી પઍછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીની સભ્ય બનનાર અને કટ-ઓફ તારીખન રોજ શેરો ધરાવતી કોઇપણ વ્યક્તિ <u>www.evotingindia.com</u> ઉપર અરજી મોકલીને લોગીન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. આમ છતાં, જો વ્યક્તિ પહેલેથી રીમોટ ઇ-વોટીંગ માટે સીડીએસએલમાં રજીસ્ટર્ડ છે તો તેમના વર્તમાન યુઝર આઇડી અને પાસવર્ડનો મત આપવા માટે ઉપયોગ કરી શકે છે.

શેરહોલ્ડરોને સીડીએસએલ ઇ-વોટીંગ સીસ્ટમ મારકત વીસી/ઓએવીએમ મારકત એજીએમમાં હાજર રહેવા માટેની સવલત પુરી પાડવામાં આવી રહી છે. વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં હાજર રહેવાની સુચનાઓ એજીએમની નોટીસમાં આપેલ છે.

રીમોટ ઇ-વોટીંગને લગતી વિગતો માટે એજીએમની નોટીસ જોવા વિનંતી છે. ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન સંબંધિત કોઇપણ પુછપરછ માટે <u>www.evotingindia.com</u> ઉપર ઉપલબ્ધ એફએક્યુ અને ઇ-વોટીંગ મેન્યુઅલ જોવા વિનંતી છે અથવા ૦૨૨−૨૩૦૫૮૫૫૪૨/૪૩ નો સંપર્ક કરવો. ઇ−વોટીંગ સંબંધિત કોઇપણ કરિયાદોના કિસ્સામાં. શ્રી રાકેશ દલ્વી, મેનેજર, સેન્ટ્લ ડિપોજીટરી સર્વિસીઝ(ઇન્ડિયા)લીમીટેડ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફ્તલાલ મિલ કંપાઉન્ડસ, એનએમ જોષી માર્ગ, લોઅર પારેલ (પુર્વ), મુંબઇ-૪૦૦૦૧ ૩નો સંપર્ક કરવો અથવા <u>helpdes</u>k <u>evoting@cdslindia.com</u> ઉપર ઇમેઇલ મોકલી શકો છો અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર કોલ કરવો.

સાગરદીપ એલોચસ લીમીટેડ સતિષ એ. મેહતા (મેનેજિંગ ડાયરેક્ટર)

સ્થળ : સાંતેજ(ગુજરાત) તારીખ : ૨૪ ઓગસ્ટ. ૨૦૨૧ ડીઆઇએન:૦૧૯૫૮૯૮૪

Date: 25th August, 2021

22

FINANCIAL EXPRESS

members at a common venue.

MAZDA LIMITED MAZDA LIMITED Regd. Office: C/1 – 39/13/16, G.I.D.C., Naroda, Ahmedabad – 382 330

CIN: L29120GJ1990PLC014293 NOTICE OF THE 31ST ANNUAL GENERAL MEETING NOTICE is hereby given that the 31st Annual General Meeting ("AGM") of the MAZDA LIMITED will be held on Friday, September 17, 2021 at 12.00 p.m.

through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM. In accordance with the General Circulars issued by Ministry of Corporate Affairs dated 08" April 2020, 13" April 2020, 05" May 2020 and 13" January, 2021 and SEBI circular dated 12" May, 2020 and 15" January, 2021 issued by the Securities and Exchange Board of India (collectively referred as 'Circulars'), the company is permitted to hold the AGM through VC/OAVM, without the physical presence of the

Notice of the 31" AGM along with the Annual Report 2020-21 are being sent only through electronic mode to those members whose e-mail addresses are registered with the company or NSDL/ CDSL (Depositories) and also being available on the website of the company i.e. www.mazdalimited.com, website of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and notice of the AGM at the website of CDSL at www.evotingindia.com

Members holding shares in physical mode or who have not registered/ updated their e-mail addresses with the company, are requested to register/ update their email addresses by writing to the company with details of folio number and attaching self-attested copy of PAN card as identity proof and self-Attested copy of any document (Driving license, Election identity card, passport) in support of address of the member at nishith@mazdalimited.com or to Link Intime using web link https://linkintime.co.in/EmailReg/Email_Register.html and members holding shares in dematerialized mode are requested to update their email addresses and bank details with their depository participants with whom they maintain their demat account.

Tax on Dividend: Members may note that the Income Tax Act, 1961, as amended by the Finance Act, 2020, mandates that dividends distributed by a company on or after 01" April, 2020 shall be taxable in the hands of members. Therefore, the company shall be required to deduct tax at source (TDS) at the prescribed rates from dividend payable to members. In order to enable us to determine the appropriate TDS rate as applicable, members are requested to submit documents in accordance with the conditions specified in the Income Tax Act, 1961 and can provide Form No. 15G/15H, to avail the benefit of non-deduction of tax at source at the link https://linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html.

Book Closure: Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the Listing Regulations that the Register of Members and Share Transfer Books of the company will remain close from 11th September, 2021 to 17" September, 2021 (both days inclusive). E-Voting: In compliance with the provisions of Section 108 of the Companies Act,

2013 read with Rule 20 of Companies (Management & Administration) Rules, 2014, as amended and as per Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations') the company has engaged services of CDSL to provide facility of remote e-voting and e-voting at the 31" AGM to transact the business set out in the notice of the AGM. The detailed instructions related to e-voting are contained in the Notice of 31" AGM. In this regard, the members are hereby further informed that:

- The cut-off date to determine eligible members to cast votes by remote e-voting and e-voting at the AGM is Friday, 10th September, 2021.
- The remote e-voting shall commence on Tuesday, 14th September, 2021 at 9.00 a.m. and ends on Thursday, 16th September, 2021 at 5.00 p.m.
- A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at AGM.
- Any person who acquires shares of the company and becomes member of the company after dispatch of notice of the AGM and holding shares as on cut-off date i.e. Friday, 10th September, 2021 may obtain the login ID and Password by sending a request at evoting@cdslindia.com. However, if a person is already registered with CDSL for e-voting than Existing User ID and Password can be used for casting vote.
- . The Members who have cast their votes through remote e-voting may also attend the Annual General Meeting but shall not be entitled to cast their vote again. The Members who have not casted their votes through remote e-voting will be able to vote at the meeting through e-voting during the AGM.
- The Board of Directors has appointed M/s Rutul Shukla & Associates, Practicing Company Secretaries, as the Scrutinizer for remote e-voting and e-voting during the AGM in a fair and transparent manner. The results of e-voting will be declared within the stipulated time and will also be posted on the Company's website, CDSL. BSE and NSE websites.
- For electronic voting instructions, members may refer the Notice of the AGM or in case if you have any query / grievances or issues regarding remote e-voting, members may refer to the FAQs and remote e-voting user manual available at www.evotingindia.com under help section or may write an email to helpdesk.evoting@cdslindia.com or may contact 022- 23058738 and 022-23058542/3. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager (CDSL), Central Depository Services (India) Limited, A Wing, 25" Floor, Marathon Futurex, Mafatlal Mill Compound, N M Joshi Marg, Lower Parel (E), Mumbai - 400 013.

Nishith Kayasth Place : Ahmedabad Company Secretary Date : 25 August, 2021

Bandhan Bank

which are intended to be sold, are enumerated hereunderin the SCHEDULE:

Description of the property to

All that part and parcel of the flat

Floor, Anjani Park, Wada Road,

Rakshewadi, Khed, Pune 410505

All that part and parcel of the flat

property admeasuring about 575 sq.ft.

alongwith adjacent terrace admeasuring

46 Sq. Ft. at Flat No. 102, On The First

admeasuring about 850 sq.ft. situated at

Flat No. 2, second floor, in wing A, in the

constructed on land bearing CTS No. 50A,

Floor, In The Building No. D named As

Sai Empire, Constructed On The Land

Bearing Gat No. 1025, Situated At

Shirwal, Tal Khandala, Dist. Satara

building named as Parvati Sadan,

situated at Erandwane, Dist. Pune

admeasuring about 545 sq.ft. and

Pune 412105 and bounded by :

East: Property of Anusaya Bisen

West: Property of Manika Shindhe

South: Property of Vithoba Bankar

The date of the tender opening and other details for the above mentioned property is as mentioned below.

herein above

North: 15 ft Road

notice cum invitation to tender, please refer to our website www.gruh.com\tender.

All that part and parcel of the property

construction thereon situated at S. No.

624, South Laxmi Nagar, Moshi Road,

property admeasuring about 541 sq.ft.

situated at S. No. 10/7, FP No. Old S.

No. 913/7, Wing B, Flat No. 5, Stilt 2nd

be sold (Secured Asset)

Name of borrower(s),

The guarantor(s),

Loan Account No.,

Date of Possession,

Tender Reference No.

Mrs. Sadhana Vilas Kedari

Mr. Sumeet Sanjeev Bhogade

Mr. Vilas Uttam Kedari

Loan A/c No. 620/1589

Mr. Rahul Arjun Nivekar

Mr. Sachin Rahul Nivekar

Loan A/c No. 620/1188

Mr. Ganesh Ashok Kale

Mr. Ashok Tukaram Kale

Loan A/c No. 616/1080

Mr. Babasaheb Tatyaram

Loan A/c No. 620/2045

Ref No. 620 - 998

Tender form fee

Mrs. Sonam Babasaheb Patole

Mr. Sainath Ramchandra Taru

Date of inspection of property

Last date and time for receiving tender

Earnest Money Deposit (EMD) payable

Date and place of opening tenders

Tender forms available at

Ref No. 620 - 721

Mrs. Vandana Rahul Nivekar

Ref No. 620 - 974

Guarantor:

04.01.2020

Guarantor:

22.07.2017

31.08.2019

Guarantor :

06.02.2020

Ref No. 616 - 915

GLAXOSMITHKLINE PHARMACEUTICALS LIMITED Regd. Office: Dr. Annie Besant Road, Worli, Mumbai - 400030 NOTICE

This is to inform the general public that Original Share Certificate(s) issued by GlaxoSmithKline Pharmaceuticals Limited, the details of which are as mentioned below, have been lost/misplaced and an application has been made by the holder(s) for issuance of duplicate Share Certificate(s) in respect thereof.

Name of the	Folio No.	Certificate	Distinct	tive No.	No. of
Holders(s)	FOIIO NO.	No.	From	To	shares
Bharat Sevashram Sangha	0312803	1142203	78386186	78386605	420
	0286874	1119770	59990974	59991120	147

Any person who has a claim in respect of the said shares or objection to the issuance of the duplicate Share Certificate shall lodge such claim or objection with the Company at its Registered Office within 15 (fifteen) days from the publication of this notice or else the Company will proceed to issue duplicate Share Certificate(s) in favor of the holder(s) without any further delay.

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL **MUMBAI BENCH**

C.A.(CAA)/ 85/MB-V/2021

In the matter of the Companies Act, 2013 (18 of 2013). AND

In the matter of Sections 230 to 232 of the Companies Act, 2013. AND

In the matter of the Scheme of Merger by absorption of Dran-Classic Automation Systems Private Limited (Transferor Company) with Dran Engineers Private Limited (Applicant Company / Transferee Company) and their respective shareholders.

Dran Engineers Private Limited

[CIN: U25209PN1994PTC077706], a company

incorporated under the Companies Act, 1956 having its registered office at S. No. 30/6, Narhe Ambegoan Road,

Dhayari, Pune - 411041.

...Transferee Company/Applicant Company

NOTICE CONVENING THE MEETING OF THE EQUITY SHAREHOLDERS OF DRAN ENGINEERS PRIVATE LIMITED.

NOTICE IS HEREBY GIVEN that in pursuance to the order dated 5th August 2021, passed in the Company Scheme Application No. C.A.(CAA)/85/MB-V/2021, the Hon'ble National Company Law Tribunal, Mumbai Bench (Hon'ble Tribunal) has directed a meeting of the Equity Shareholders of Dran Engineers Private Limited (Transferee Company / Applicant Company) be convened and held for the purpose of considering, and if thought fit, approving, with or without modification, the Scheme of Merger by absorption of Dran-Classic Automation Systems Private Limited (Transferor Company) with Dran Engineers Private Limited (Transferee Company) and their respective shareholders ('Scheme').

In pursuance of the said order and as directed therein further notice is hereby given that the Hon'ble Tribunal convened meeting of the Equity Shareholders of the Applicant Company will be held at Registered Office of the Applicant Company situated at S. no. 30/6, Narhe Ambegoan Road, Dhayari, Pune - 411041 on Monday, 27th September 2021 at 11 AM, at which time and place the said Equity Shareholders are requested to attend. A copy of the Notice along with explanatory statement including inter alia the scheme under Section 230 to 232 and 102 of the Companies Act, 2013 read with Rule 6 of the Companies (Compromise, Arrangement and Amalgamation) Rules, 2016 can be obtained free of charge at the Registered Office of the Applicant Company or at the office of its Authorised representative Haresh Upendra & Co., at 1st Floor, Matruchaya building, Plot no 27, Mitramandal Colony, Parvati, Pune - 411009. Persons entitled to attend and vote at the meetings, may vote in person or by proxy, provided that all proxies in the prescribed form, duly signed or authorized by the said person, are deposited at the Registered Office of the Applicant Company not later than 48 hours before the meetings. Form of proxy can be obtained at the Registered Office of the Applicant Company.

The Hon'ble Tribunal has appointed Mr. Anil Nagpure, Managing Director of the Applicant Company; failing him, Sagar Nagpure, Director of the Applicant Company; failing him, Sachin Nagpure, Director of the Applicant Company as Chairperson of the said meeting of the Equity Shareholders of the Applicant Company. The above-mentioned Scheme of Merger, if approved by the meeting, will be subject to the subsequent approval of the Hon'ble Tribunal.

Regional Off.: Netaji Marg, Nr. Mithakhali Six Roads,

Secured Debt as on date of Demand

Notice and as on 31.07.2021 (in Rs.)

borrower(s) from the date of demand

which includes amount paid by the

notice till date, if any, with further

Rs.13,30,040.50 as on 04.01.2019

Rs.16,09,300.25 as on 21.01.2017

Rs.24,55,362/- as on 31.07.2021

Rs.56,90,801/- as on 31.07.2021

Rs.24,07,164.09 as on 31.07.2019

Rs.31,18,470/- as on 31,07,2021

Rs.100/- per tender for the above property payable by Banker's Cheque/Demand draft

10% of the offer price is to be paid along with tender by way of Bankers cheque/Demand

The tenders shall be opened on 16.10.2021at Bandhan Bank's Regional Office as stated

Bandhan Bank Ltd., "L" Square, Office No. 2, 1st Floor, Sanghvinagar, Parihar Chowk,

11.10.2021 up to 05:00 P.M. at the Regional office of Bandhan Bank Limited,

Netaji Marg, Near Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-380 006

favoring "Bandhan Bank Limited" (non-refundable)

20.09.2021 between 10.00 A.M. to 5.00 P.M.

Draft favoring at "Bandhan Bank Limited"

Bandhan Bank Limited-Pune Aundh Branch

The sale of the property will be on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS", "NO RECOURSE BASIS" and "WHATEVER THERE IS

BASIS". The property may not be sold below the Reserve Price. The Bank submits that we have not received any intimation about litigations,

disputes filed or pending against the aforesaid property mortgaged in favor of the Bank. The borrower(s)/mortgagor(s) can redeem the

mortgage till the date of sale confirmation as provided under section 13(8) of the SARFAESI Act. For detailed terms and conditions of the sale

Near Radhika Hotel, Aundh, Pune 411007, Maharashtra.

Name of contact person(s): Mr. Pankaj Rajani : 9333153531

All that part and parcel of the flat property Rs.38,01,738.27 as on 25.06.2018 Rs. 85,00,000/-

Rs.18,55,655/- as on 31.07.2021

interest, costs, charges, etc.

Ellisbridge, Ahmedabad-6. Fax: +91-79-26560649

Date: 25th August 2021 Place: Pune

Toll Free No.: 18002335300

SALE NOTICE CUM INVITATION TO TENDER

Sale notice cum invitation to tender is hereby given to the public in general and in particular to the borrower(s) and that the below described

immovable property which is mortgaged to erstwhile GRUH (Now "the Bandhan Bank") is put for sale. The specific details of the properties,

Website: www.bandhanbank.com

By order of the Board,

Mr. Anil Nagpure Chairperson Appointed for the meeting of the Equity Shareholders of Applicant Company

Reserve price

Rs.12,56,000/-

Rs.16,00,000/-

EMD 10% of the

Rs.25,00,000/-

offer price

Bandhan Bank Limited

Authorised Officer

EMD 10% of the

offer price

offer price

EMD 10% of the

offer price

EMD 10% of the

and EMD

payable

(in Rs.)

SVARAJ TRADING AND AGENCIES LIMITED

CIN: L51100MH1980PLC022315 Address: Office No. 30, 380/82 Amruteshwar Co- operative Housing Soc. Ltd. 2nd floor, Jagannath Sunkersett Road, Mumbai, Maharashtra, 400002; Tel: 022-24964656-60; Fax: 022-24963055;

Email: svarajtradingagencies@gmail.com; Website: www.svarajtrading.com NOTICE OF 41" ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that the 41st Annual General Meeting (AGM) of the Company will be held on Saturday, September 18, 2021 at 12:30 p.m. (IST) through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice convening the AGM. Members will be able to attend and participate in the AGM through VC/ OAVM facility only.

The AGM will be convened in compliance with the applicable provisions of the Companies Act, 2013 "Act") and the Rules framed thereunder, Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") read with the provisions of Circulars dated May 05, 2020, April 13, 2020, April 08, 2020, and January 13, 2021 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "MCA Circulars") and circular dated May 12, 2020 and January 15, 2021 issued by SEBI.

In compliance with the circulars as detailed above, Notice of the AGM along with the Annual Report for the financial year 2020-2021 has been sent by August 25, 2021 only through electronic mode to those members of the Company whose email addresses are registered with the Company/ Depository Participant(s)/RTA. The Notice of AGM along with the Annual Report for the financial year 2020-2021 is also available on the Company's website at www.svaraitrading.com under Investor relations tab > Financial Statements > Annual Reports 2020-2021 and on the websites of the BSE Limited at www.bseindia.com

The documents referred to in the Notice of the AGM are available electronically for inspection without any fee by the Members from the date of circulation of the Notice of AGM up to the date of AGM and will also be available for inspection during the AGM. Members seeking to inspect such documents can

send an email to svarajtradingagencies@gmail.com. MANNER OF REGISTRATION OF EMAIL ADDRESSES

Members who have not yet registered their email addresses and phone number are requested to

- Members holding shares in physical mode are requested to update their email addresses and phone number by writing to the Registrar & Share Transfer Agent (RTA)/Company at mt.helpdesk@linkintime.co.in and svarajtradingagencies@gmail.com respectively, along with the copy of the signed request letter mentioning the name, folio no., address of the Member self-attested copy of the PAN card and self-attested copy of any document (e.g.: Driving License, Bank Statement, Election Identity Card, Passport, Aadhaar Card) in support of the address of the
- Members holding shares in dematerialized mode are requested to register/update their email addresses and phone number with the relevant Depository Participants.

Notice is further given pursuant to Section 91 of the Act read with Rules made thereunder and Listing

Regulations that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 11, 2021 to September 18, 2021 (both days inclusive) for the purpose of Annual General Meeting.

In compliance with the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Secretarial Standards on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India and Regulation 44 of the Listing Regulations, Members have been provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using an electronic voting system (remote e-Voting). The Company has engaged the services of CDSL for providing facility for remote e-Voting, participation in the AGM through VC/DAVM and voting at the AGM. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on September 10, 2021 ("cut-off date").

The manner of remote e-Voting and voting at the AGM by the Members holding shares in the dematerialized mode, physical mode and for members who have not registered their email addresses

The remote e-Voting commences on September 15, 2021 at 9.00 a.m. (IST) and ends on September 17, 2021 at 5.00 p.m. (IST). Members may cast their votes electronically during this period. The remote e-Voting shall be disabled by CDSL thereafter. Those members, who shall be present in the AGM through VC/ OAVM facility and had not cast their votes on the resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting at the AGM. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently.

The Members who have cast their votes by remote e-Voting prior to the AGM may also attend/ participate in the AGM through VC/ OAVM but shall not be entitled to cast their votes again.

Any person who becomes a member of the Company after dispatch of Notice of the AGM and holding shares as on the cut-off date i.e. September 10, 2021 may obtain the User ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com or mt.helpdesk@linkintime.co.in. However, it the member is already registered with CDSL for e-Voting then he can use the existing user ID and Password for casting the vote through e-Voting.

in case of any queries/grievances relating to remote e-Voting or e-Voting at the AGM, please refer to the Frequently Asked Questions (FAQs) and e-Voting user manual for Members available at www.evotingindia.com, under help section or contact Mr. Rakesh Dalvi, Manager, (CDSL) or send an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.

> By Order of the Board of Directors of Svaraj Trading and Agencies Limited

Date: August 25, 2021 Place: Mumbai

Harendra Gupta Managing Director DIN: 05335662

S V TRADING AND AGENCIES LIMITED

CIN: L51900MH1980PLC022309 Address: Shop No. 006., Building No. 1, Vasant Alshwarya Co-operative Housing Society Limited, Mathurdas Extension Road, Kandivali-West, Mumbai, Maharashtra, 400067; Tel: 022-65027372; Fax: 022-65027372; Email: svtradingandagencies@gmail.com Website: www.svtrading.co.in

NOTICE OF 41" ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that the 41st Annual General Meeting (AGM) of the Company will be held on Saturday, September 18, 2021 at 11.00 a.m. through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice convening the AGM. Members will be able to attend and participate in the AGM through VC/ OAVM facility only

The AGM will be convened in compliance with the applicable provisions of the Companies Act, 2013

("Act") and the Rules framed thereunder, Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") read with the provisions of Circulars dated May 05, 2020, April 13, 2020, April 08, 2020 and January 13, 2021 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "MCA Circulars") and circular dated May 12, 2020 and January 15, 2021 issued by SEBI, without the physical presence of the Members In compliance with the circulars as detailed above, Notice of the AGM along with the Annual Report

for the financial year 2020-2021 has been sent by August 24, 2021 only through electronic mode to those members of the Company whose email addresses are registered with the Company/ Depository Participant(s)/RTA. The Notice of AGM along with the Annual Report for the financial year 2020-2021 is also available on the Company's website at www.svtrading.co.in under Investor Tab > Financial statement > Annual Reports and on the websites of the BSE Limited at www.bseindia.com

The documents referred to in the Notice of the AGM are available electronically for inspection without any fee by the Members from the date of circulation of the Notice of AGM up to the date of AGM and will also be available for inspection during the AGM. Members seeking to inspect such documents can send an email to sytradingandagencies@gmail.com.

MANNER OF REGISTRATION OF EMAIL ADDRESSES

Members who have not yet registered their email addresses and phone number are requested to follow the process mentioned below:

- Members holding shares in physical mode are requested to update their email addresses and phone number by writing to the Registrar & Share Transfer Agent (RTA)/Company at mt.helpdesk@linkintime.co.in and svtradingandagencies@gmail.com_respectively, along with the copy of the signed request letter mentioning the name, folio no., address of the Member, self-attested copy of the PAN card and self-attested copy of any document (e.g.: Driving License, Bank Statement, Election Identity Card, Passport, Aadhar Card) in support of the address of the
- Members holding shares in dematerialized mode are requested to register/update their email addresses and phone number with the relevant Depository Participants.

Notice is further given pursuant to Section 91 of the Act read with Rules made thereunder and Listing Regulations that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 11, 2021 to September 18, 2021 (both days inclusive) for the purpose of Annual General Meeting.

In compliance with the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Secretarial Standards on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India and Regulation 44 of the Listing Regulations Members have been provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using an electronic voting system (remote e-Voting). The Company has engaged the services of CDSL for providing facility for remote e-Voting, participation in the AGM through VC/OAVM and voting at the AGM. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on September 10, 2021 ("cut-off

The manner of remote e-Voting and voting at the AGM by the Members holding shares in the dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of AGM.

The remote e-Voting commences on September 15, 2021 at 9.00 a.m. (IST) and ends on September 17, 2021 at 5.00 p.m. (IST). Members may cast their votes electronically during this period. The remote e-Voting shall be disabled by CDSL thereafter. Those members, who shall be present in the AGM through VC/ OAVM facility and had not cast their votes on the resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting at the AGM. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it

The Members who have cast their votes by remote e-Voting prior to the AGM may also attend/ participate in the AGM through VC/ OAVM but shall not be entitled to cast their votes again. Any person who becomes a member of the Company after dispatch of Notice of the AGM and holding

shares as on the cut-off date i.e. September 10, 2021 may obtain the User ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com or mt.helpdesk@linkintime.co.in. However, if the member is already registered with CDSL for e-Voting then he can use the existing user ID and Password for casting the vote through e-Voting. In case of any gueries/grievances relating to remote e-Voting or e-Voting at the AGM, please refer

to the Frequently Asked Questions (FAQs) and e-Voting user manual for Members available at www.evotingindia.com, under help section or contact Mr. Rakesh Dalvi, Manager, (CDSL) or send an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.

> By Order of the Board of Directors of S V Trading and Agencies Limited

Date: August 25, 2021 Place: Mumbai

DIN: 06522898

Managing Director

Gopal Lal Paliwal

9976981

Description of the Secured Assets/Immovable Properties: Schedule A - All That Piece And Parcel Of Immovable Property Bearing Flat No.614, 6th Floor, Building No. A/4, Admeasuring 19.32 Sq. Meters, (Equivalent To 208 Sq. Feet) Along With Undivided Share

as on 19.04.2021

& 27.04.2021

23.08.2021

Rs. 14,02,484/- as on Mr. Vinay Kumar (Borrower) & Mrs. Bindu Kumari (Co-borrower) 29.04.2021 & 30.04.2021

Description of the Secured Assets/Immovable Properties: Schedule A - All that the Flat bearing No. 403 and Wing "C" on the 4TH Floor, unit admeasuring 36.75 Sq.Mts means 52.13 Sq.Mts Saleable area with an adjoining terrace, in the building known as "AYODHYA PURAM", constructed on the land bearing Gat No. 1947 (Old Gat No. 3260) of Village Chakan, Taluka Khed, District Pune and within the Registration Division District Pune, Sub Division and within Jurisdiction of Sub Registrar Khed Bounded as under: North: By Wing-D, East: By Outside of the Building, South: By Flat No. C - 404,

Sd/- Authorized Officer

SAGARDEEP ALLOYS LIMITED Sagar Deep

CIN: L29253GJ2007PLC050007

Registered Office: Plot No. 2070, Rajnagar Patiya, Santej Khatraj Road, Santej Kalol Gandhinagar-382721 Email: secretary@sdalloys.com; Website: www.sdalloys.com

PUBLIC NOTICE The Company has received mail form the National Stock Exchange of India Limited (NSE) informing circulation of "Unsolicited Massages" with reference to the equity shares of the Company to induce investment in the equity shares of the Company indicating target prices, by some unregistered or unauthorized entities.

We would like to categorically clarify that the Company, its Promoter, Promoter Group, Directors and KMPs do not have any role in circulation of such massages by unknown persons/entities. As we came to know from NSE about it, the Company is under process to lodge the Police Complaint regarding the same.

All shareholders and Investors are hereby advised/cautioned not to rely on such unsolicited massages/SMSs circulated by unauthorized entities. We also advice shareholders and investors to exercise appropriate due diligence before trading and/or investing in the shares of the Company and to take informed investment decision without being influenced by any such unsolicited massages/SMSs. If any investors deals in the shares of the Company based on such Massage/SMSs or incur losses, the Company, it's Promoters, Directors and any Officer of the Company will not be responsible or liable for the same.

The Company is making all requisite disclosures from time to time and same are uploaded on the website of the NSE and also on the website of the Company

We strongly advice the investors to go through only NSE website i.e. www.nseindia.com for any news and/or disclosures relating to the Company. For any information and /or clarification from the Company, the investors can contact with the Company at secretary@sdalloys.com.

Place: Santej (Gujarat) Date: August 24, 2021

For Sagardeep Alloys Limited Satish A. Mehta (Managing Director) DIN: 01958984



POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY) (As per Rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of the TATA Capital Housing Finance Limited., under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated as below calling upon the Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the said notice.

The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular and the public, in general, that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the TATA Capital Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs etc. from date of demand notice.

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Loan	Name of Obligor(s)/ Legal Heir(s)/	Demand Notice	Date of
A/c No.	Legal Representative(s)	Amount & Date	Possessio
10128746	Mr. Bharat Tukaram Aagale (Borrower) & Mr. Tushar Bharat Aagale & Mrs. Shaila Bharat Aagale (Co-Borrower)	Rs. 10,17,463/- as on 19.04.2021 & 27.04.2021	23.08.202

And Parcel of Immovable Property Bearing Apartment/Flat No. 3, Building No. A/1, Admeasuring 324.85 Sq. Ft. I.E. 30.18 Sq. Meters. Carpet Along With Open Balcony Admeasuring 2.47 Sq. Meters, and Dry Balcony Admeasuring 1.29 Sq. Meters, Gat No. 289, Admeasuring 01 H. 54.80 Area I.E. 15480 Sq. Meters out of 05 H 74 Area out of 06 H 16 Area Undivided Share In The Land Of Road & Cop, In "Vinayak Hills", At of Moje Village Chikhalse, Taluka: Maval, Dist: Pune., Bounded As Follows: East By: By Gat No. 24 25 & 30, West By : By Gat No. 291, North By : By Road, South By : By Plot Of Srk Promoters & Builders out of Gat No. 289. 9621815 Mr. Gyanaranjan B Jena (Borrower) & Rs. 7,42,518/- as on

Mrs. Purnima Gyana (Co-Borrower) 19.04.2021 & 26.04.2021 Description of the Secured Assets/Immovable Properties: Schedule A - All that piece & parcel of immovable property bearing Flat No. 411, on the 4th Floor of Wing H, admeasuring 299 sq. fts., i.e. 27.78 sq. mtrs., Along With Adjacent Terrace admeasuring 3.99 Sq. Mtrs., i.e. 43 sq. fts., & Parking admeasuring 2 sq. mtrs., in the scheme known as "Aalpa Ghar Chakan Talegaon", situate at Gat No. 223, 224, 225, 229/3, of Moje Village Bhamboli, Ta: Khed, Dis: Pune.

Mr. Hemraj Vasudeo Joshi Rs. 6,94,511/-10323292 (Borrower) & Mrs. Mohini Hemraj as on 12.04.2021 23.08.2021 Joshi (Co-Borrower) & 27.04.2021 Description of the Secured Assets/Immovable Properties: Schedule A - All That

Piece And Parcel Of Immovable Property Bearing Flat No. 108, on the 1st Floor of Building No. 6, carpet area admeasuring 21.93 Sq. Mtrs., (236.05 Sq. Feet), and Enclosed Balcony Admeasuring 4.08 Sq.Mtrs (43.91 Sq.Feet), in the scheme known as "Atulya", Located On Plot Admeasuring 1827.45 Along With FSI Consume As Per Mentioned In Rera Situated On The Said Property Admeasuring 2 Hector 97 Ares I.E. 29700 Sq. Mtrs, Out of Gat No. 405/3486 Totally Admeasuring 03 Hector 23 Ares (Including Pot Kharaba) Of Maval, Pune, Maharashtra.

Rs. 29,48,793/- as on Mr. Nilesh Gaikwad (Borrower) & 10345239 23.08.2021 Mrs. Poonam Gaikwad (Co-Borrower) | 12.05.2021 & 13.05.2021 Description of the Secured Assets/Immovable Properties: Schedule A-All That Piece And Parcel of Immovable Property Bearing Flat No. 803, Admeasuring 646 Sq. Feet, i.e.

60.01 Sq. Meters Along With Terrace Admeasuring 113.00 Sq. Feet, i.e. 10.49 Sq. Meters On Eight Floor, Along With One Car Parking Space Admeasuring 100.00 Sq. Feet, i.e. 9.29 Sq. Meters In Building No. B/2, In "Woodsvilla Phase - 1 Co - Operative Housing Society Ltd." Constructed On The Land Bearing Gat No. 97, Situated At Of Village: Borhadewadi Ta: Haveli, Di: Pune. Bounded As Follows: East By: 18 mtrs. Wide Road, West By: 2 mtrs. Wide Road & Remaining area of Gat No. 97, North By: Remaining area of Gat No. 97, South By : Remaining area of Gat No. 97.

Mr. Sandeep Shankar Kumbhar Rs. 17,54,224/-10016735 & 23.08.2021 (Borrower) & Mrs. Rupali Sandeep as on 17.04.2021 10042552 Kumbhar (Co-borrower) & 27.04.2021 Description of the Secured Assets/Immovable Properties: Schedule A - All that piece

and parcel of land bearing Plot No. 26 having area admeasuring 540.4 Sq. Mt. as per CTS and are admeasuring 528.25 Sq. Mt. as per 7/12 out of which eastern side Plot area admeasuring 270.2 Sq. Mt. as per CTS and area admeasuring 264.12 Sq. Mt. as per 7/12 extract extracting having CTS No. 7553, situated on Survey No. 386/1 New, 639 Old in Mascarnhas Colony, situated at village Talegaon Dabhade, Tal. Maval, Dist. Pune and within the limits of Registration Dist. Pune and Sub Registration Maval and within the limits of Talegaon Dabhade Municipal Council, and which is Bounded as follows: On or Towards East: CTS No. 7552, On or Towards West: Remaining part of Plot No. 26 and CTS No. 7553, On or Towards South: CTS No. 7554, On or Towards North: Road,

Schedule B - A Flat bearing No. 301 at the Third Floor in the Scheme known as "Crystal Nest" being constructed at the land more particularly described in Schedule I, hereinabove written and the Flat Salable area is admeasuring 568 Sq. Ft. equivalent to 52.78 Sq. Mt. (carpet area is admeasuring 381 Sq. Ft.).

Rs. 4.31.606/-Mrs. Shobha Shivaji Waghmare 10058573 & (Borrower) & Mrs. Mudrukabai as on 11.05.2021 23.08.2021 10064858 Shivaji Waghmare (Co-borrower) & 14.05.2021 Description of the Secured Assets/Immovable Properties: Schedule A - Flat / Unit

bearing No. 710, situated on the Seventh Floor having area 16.48 Sq. Mtrs. (Carpet) along with the area including the allocated right to use of all common restricted areas in the "A1" building in the project known as "Mantra City 360", which is constructed on the land referred in Schedule "C" together with enclosed balcony having area 2.53 sq. Mtrs. And Terrace having area 1.56 Sq. Mtrs. And Dry balcony / dry terrace having area admeasuring about 0 Sq. Mtrs.

Schedule B - Present phase/project is being developed by consuming 4940.68 square meter FSI and same is situated on land described in Schedule C

Schedule-C -All that piece and parcel of land situated at village Mouje Talegaon Dabhade, Taluka Mayal, within the jurisdiction of Talegaon Dabhade Municipal Council and Sub Registrar Maval bearing Survey No. 389/1/A, (Old S. No. 646), totally admeasuring 6 Hector 61 R out of which area admeasuring 5 Hectare 79 Are is the subject property is Bounded as follows: East: By remaining area S. No. 389/1/A part and S. No. 388 and By Road, West : DP Road, S. No. 389/1/B and S. No. 428, South : S. No. 390 and By Road North: By Nala, Along with all Easementary rights of way and all benefits and other rights and all the things attached to it and on, over, above and below it.

Mr. Shrikant Dovandey Pawar Rs. 48.35.847/-

165915 &	(Borrower) & Mrs. Madhuri	as on 30.04.2021	23.08.2021	
0167560	Shrikant Pawar (Co-borrower)	& 14.05.2021		
100 CO TO TO TO THE	of the Secured Assets/Immovable			

consisting of Flat No. 8 admeasuring area 52.49 Sq. Mtrs. On the Fourth Floor along with 11.11% Undivided share and Flat No. 9 admeasuring area 52.49 Sq. Mtrs. On the Fifth Floor along with 11.11% undivided share in "Santkrupa Apartment" constructed on land bearing Survey No. 434 Hissa No. 6A/1+6B/5, CTS No. 2613, 2613/1 to 7 Situated at Bhosari (Kasarwadi), Tal. Haveli, Dist, Pune. Mrs. Sonali Rahul Unde (Borrower) Rs. 9.14.066/-

In The Land Of Road &	C.O.P. In The Scheme Known As "Xrbia Ambi ", Situate	a At Ga
No.36, 37, 39, 40 & 339,	, Total Admeasuring 46450.00 Sq. Meters, Of Vil: Ambi, Ta	:Maval
Dis:Pune, Maharashtra-	-410507.	

& Mr. Rahul Suryabhan Unde

(Co-borrower)

West: By Lobby & Stair Case.

Date: 26.08.2021, Place: Pune For Tata Capital Housing Finance Limited Ahmedabad

financialexp.epapr.in

Date: 26/08/2021

Place: Pune